



માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે
રાઈટ ટુ ઈન્ફોરમેશન એક્ટના કલમ – ૪ (ડી) હેઠળ
પ્રોએક્ટીવ ડીસ્કલોઝર–૨૦૨૩
પૂર્વ (વરાધા) ઓન કચેરી–એ
સુરત મહાનગરપાલિકા
સુરત



મુદ્દા નં.૦૧ :– સંસ્થાના કાર્યો અને ફરજો :–

૧.૧ જાહેરતંત્ર ઉદેશ / હેતુ :–

➢ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને અસરકારક અને ઉત્તરદાયી બનાવવાના સરકારશીના પ્રજાલક્ષી ધ્યેયને મૂર્તિમંત સ્વરૂપ આપવા શહેરની પ્રજાને નાગરીક સુવિધાઓ પૂરી પાડવાનો ઉદેશ / હેતુ રહેલો છે.

૧.૨ જાહેર તંત્રનું મિશન / દૂરંદેશીપણું (વિઝન) :–

➢ શહેરમાં વધારે સારો સ્થાનિક સ્વરાજ્ય વહીવટ સુનિશ્ચિત કરવાના ઉદેશથી પ્રજાલક્ષી બાબતોને મહત્વ આપવામાં આવેલ છે. જાહેર સુખાધિકારો, પાણી, રસ્તા, ગટર, આરોગ્ય, લાઈટ જેવી પ્રાથમિક અને પાયાની સુવિધાઓ તેમજ આધુનિક ટેકનોલોજીથી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા વધુ સરળ પ્રક્રિયા અપનાવી સમયની બયત સાથે સાથે થાય તેવો ઝડપી અને વ્યવહારું ઉકેલ લાવવાની દિશામાં પ્રયાસ કરવાનું મિશન રહેલ છે.

૧.૩ જાહેર તંત્રનો ટુંકો ઇતિહાસ અને રચનાનો સંદર્ભ :–

➢ સુરત શહેર સુધરાઈની સ્થાપના તા. ૧૫/૦૫/૧૮૫૨થી કરવામાં આવી.
➢ તા. ૦૧/૧૦/૧૯૬૬ થી મહાનગરપાલિકામાં રૂપાંતર થયું.
➢ અંદાજે ૧૨૬.૫૧૫ ચોરસ કિ.મી.નું ક્ષેત્રફળ ધરાવતાં સુરત મહાનગરપાલિકા કોર્પોરેશનની સને ૨૦૧૧ની વસ્તી ૪૪,૬૬,૮૨૬ ની છે.
➢ ધી બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ–૧૯૪૮ની જોગવાઈ અનુસાર તંત્રની રચના કરવામાં આવેલ છે તેમજ આ અધિનિયમની જોગવાઈઓ મુજબ વહીવટ ચલાવવામાં આવે છે.

૧.૪ જાહેરતંત્રની ફરજો :–

➢ લોકોની રજુઆતોનો ઝડપી અને ન્યાયપૂર્ણ નિકાલ કરવા અને લોકો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહારનો ઉદેશ પાર પડે તે રીતે પારદર્શકતા અને પ્રમાણિકતાભ્યો વહીવટ ચલાવવાની ફરજ રહેલી છે.

૧.૫ જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ / કાર્યો : -

મહાનગરપાલિકા ધ્વારા દી બી.પી.એમ.સી. એકટની (૧૯૪૭) કલમ-૬ માટે મુજબ કરવામાં આવતી ફરજિયાત પ્રવૃત્તિઓ નીચે મુજબ છે.

- (૧) શહેરના તમામ રસ્તાઓ ઉપરથી કચરો સાફ કરાવવો,
- (૨) સુઅંજ અને દુર્ગંધ મારતો પદાર્થ, કચરો, પુંજી એકઠા કરવા અને લઈ જવા
- (૩) મોરીઓ અને ગટરકામ તથા સાર્વજનિક શૌચાલયો સાફ કરાવવા અને નિભાવવા અંગે
- (૪) આગ ઓલવવા અને આગ સામે જીદળી અને મિલકતનું રક્ષણ કરવું
- (૫) સપર્શજન્ય રોગો સામે પગલાં લેવા
- (૬) સાર્વજનિક રસ્તાઓ ઉપર દિવાબતીની વ્યવસ્થા
- (૭) મ્યુ. ઓફિસ અને મ્યુનિ.ને પ્રાપ્ત થયેલા સ્મારકો, ખુલ્લી જગ્યાઓ નિભાવવા
- (૮) કોર્પોરેશનને પ્રાપ્ત થયેલા રસ્તાઓ અને સાર્વજનિક જગ્યાઓના નામ આપવા
- (૯) મડાના નિકાલ માટેની જગ્યાઓ નિભાવવી અને નિયમત ન કરવા અંગે
- (૧૦) સાર્વજનિક માર્કેટો અને કટલખાના બાંધવા અને સંપાદન કરવા અને નિભાવવા
- (૧૧) હોર પુરવાના ડબ્બા બાંધવા, સંપાદન કરવા અને નિભાવવા
- (૧૨) શીતળાની રસી ટાંકવા
- (૧૩) પ્રાથમિક શિક્ષણ માટે શાળાઓ નિભાવવી અને તે માટે જગ્યાની સગવડ કરી આપવી
- (૧૪) આરોગ્યને હાનિ કરે તેવા લતાઓ સુધારવા અને ઉપદ્રવકારક ઝડપ-પાલો કાઢી નાખવા
- (૧૫) જન્મ-મૃત્યુની નોંધણી
- (૧૬) સાર્વજનિક રસ્તાઓ, પુલો, પેટા માર્ગો નિભાવવા અને બનાવવા
- (૧૭) સાર્વજનિક રસ્તાઓ, પુલો પરના હરકત અને બહાર નીકળતા કોઈપણ બાંધકામો કઠાવી નાખવા
- (૧૮) ભયંકર રોગો થતા અટકવવા અને તેનો ફેલાવો રોકવો
- (૧૯) જોખમકારક ઈમારતો અને જગ્યાઓ સુરક્ષિત કરવી અથવા કાઢી નાખવી
- (૨૦) દુષ્કાળ અને અધ્યતના વખતે રાહતની જોગવાઈ કરવી.
- (૨૧) રેવન્યુ આવકના ૧૦% સુધી સ્લેમ વિસ્તારોમાં ખર્ચ કરવા અંગે.

૧.૬ જાહેર તંત્ર ધ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ : -

(૧) પાણી પુરવઠો

જુદા જુદા તેમમાંથી તથા તેના સબસોઈલ બેઝીનમાં બોર / કુવામાંથી પંપીગ ધ્વારા પાણી પુરવઠો મેળવી યોગ્ય શુદ્ધિકરણ પ્રક્રિયા બાદ વિવિધ ઝોનમાં ઈ.એસ.આર. મારફતે વિતરણ ધ્વારા પીવાનું પાણી પુરવામાં આવે છે તેમજ તેને લગત ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે.

(૨) સફાઈ સેવા

સમગ્ર શહેરમાં વપરાશી ગંદા પાણીના નિકાલ માટે ઓપન ગટરોથી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમજ આંશિક રીતે ભુગર્ભ ગટર યોજના પણ અમલમાં મુકાયેલ છે. સાથે સાથે વોડર્મા ઉત્પન્ન થતો કચરો અને ખાતાના વાહનો તથા પ્રાઈવેટ વાહનો ધ્વારા નિકાલ કરવામાં આવે છે. તેમાં આધુનિક પદ્ધતિથી હાઈડ્રોલીક કન્ટેનરો, કેપીયરો ધ્વારા જુદા જુદા વોર્ડમાં અને સ્લેમ વિસ્તારોમાં ઉત્પન્ન થતો કચરો કન્ટેનર

ધ્વારા નિકાલ કરવામાં આવે છે. ઉપરાંત, મૃત પશુઓનો નિકાલ, મર્યાદી તેમજ મટન માર્કેટમાંથી નીકળતા વેસ્ટનો નિકાલ, કુતરાના ત્રાસ નિકાલની કામગીરી, સેપ્ટીક ટેક સફાઈની કામગીરી કરવામાં આવે છે.

(૩) દીવાબતી સેવા (લાઈટ શાખા)

રોશની વિભાગ ધ્વારા સુરત શહેરના સમગ્ર વિસ્તારો તેમજ શહેરના સુશોભન માટે તૈયાર કરવામાં આવેલ કુવારાઓ અને મ્યુ. હસ્તકના બિલ્ડીંગ તેમજ શાળાઓની લાઈટીંગ વ્યવસ્થા કરવામાં આવે છે.

(૪) સીવીલ શાખા (રસ્તાઓની સુવિધા) અન્વયે

શહેરમાં કાચા રસ્તાઓ, મેટલ રોડ, પેવર રોડ, સિમેન્ટ રોડ વિગેરે જુદા જુદા રસ્તાઓ તૈયાર કરી નિભાવવામાં આવે છે. નવ ઈચ્છા નાની તેમજ નવ ઈચ્છા મોટી ઓપન ગાટર તેમજ સ્ટોર્મ વોટર ડ્રેઇન / કેનાલ તૈયાર કરવામાં આવે છે.

(૫) સ્લમ શાખા

ગ્રાંટ / લોન ઉપલબ્ધ થયે તેમજ ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૮ના સેક્શન-૬૩(૨)ની જોગવાઈ મુજબ પછાત વિસ્તારોની સુધારણા માટેની કામગીરી તથા મ્યુ. કોપો. હસ્તકની સ્લમની જમીનનું વિતરણ / વેચાણ કરવું એ સામાન્ય ઉદેશ રહેલ છે. જેમાં આર્થિક અને સામાજિક રીતે પછાત તેમજ ઘરવિહોણાં લોકો માટે રાજ્ય સરકારની પોલીસી અનુસાર આવાસ યોજના અમલમાં મુકાય છે.

(૬) જમીન મિલકત વિભાગ :—

- કાર્યપાલક ઈજનેરની દેખરેખ હેઠળ વિકાસ નકશાનું અમલીકરણ તથા જાહેર હેતુના અનામત પ્લોટોને લગત કાર્યવાહી. ટેમ્પરરી સ્ટ્રક્ચરની મંજુરી, ,હોંડિંગની તેમજ મોબાઈલ ટાવરની મંજુરી આપવાની કામગીરી.
- આસી. કમિશનની દેખરેખ હેઠળ પાર્ટીલોટ,કોમ્પ્યુનીટી હોલ વિગેરે ભાડે આપવા,મહાનગરપાલિકાના આવાસોની હપ્તાની વસુલાત, મહાનગરપાલિકાના પ્લોટને ભાડે આપવા/વસુલાત કરવાની કામગીરી,હોડીંસની તેમજ લાઈટપોલ પરના બોર્ડ બેનરની ફી ની વસુલાત તથા સુરત મહાનગરપાલિકા તથા અન્ય સરકારી મિલકત પરના પરવાનગી વિનાની એડવટાઈઝમેન્ટ સબબે દંડની વસુલાતની કામગીરી.

(૭) શહેર વિકાસ / ટાઉન પ્લાનીંગ વિભાગ :—

- નવા લે—આઉટ પ્લાન, નવી બાંધકામ વિકાસ પરવાનગી, પ્લીન્થ સર્ટીફીકેટ, વપરાશ પરવાનગી, નગરરચના યોજનાનું અમલીકરણ,સબપ્લોટીંગ,એમાલગમેશનની મંજુરી નિયમોનુસાર આપવાની કામગીરી કરવામાં આવે છે.
- રસ્તાઓનું દબાણ હટાવવા બાબત તથા ભયજનક બાંધકામ જો મિલકતધારક દુર ન કરે તો મિલકતધારકના ખર્ચે, જોખમે દુર કરવાની કામગીરી કરવામાં આવે છે.

(૮) આકારણી અને સીધાવેરા વિભાગ :—

ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૮ની કલમ-૧૨૭થી શહેરની મિલકતો ઉપર જનરલ બોર્ડ ધ્વારા નક્કી કરાયેલા દરથી મિલકતવેરો વસુલવામાં આવે છે તેમજ પ્રોપર્ટીમાં નામ ટ્રાન્સફર, જનરલ એસેસમેન્ટ દર ચાર વર્ષે કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.વધુમાં ઈસ્ટઝોન એ ખાતે નાગરીક સુવિધા કેન્દ્રમાં પણ ટેક્ષ ભરવાની સુવિધા છે.

(૯) પુર્વ પ્રાથમિક શિક્ષણ / બાલમંદિર, નગર પ્રાથમિક શિક્ષણ તેમજ ઉચ્ચતર શિક્ષણ :—

મહાનગરપાલિકા હસ્તક દશ બાલમંદિરોનો વહીવટ ચલાવવામાં આવે છે તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત પછી પ્રાથમિક શાળાઓનો વહીવટ કરવામાં આવે છે તેમજ શ્રી વી. એમ. મહેતા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું સંચાલન મહાનગરપાલિકા ધ્વારા કરવામાં આવે છે.

(૧૦) મોટરવાહન શાખા :—

જાહેર પબ્લીકને ટેન્કર ધ્વારા જરૂરીયાત મુજબ નક્કી કરેલ પાણી પહોંચાડવું.

(૧૧) ગાર્ડન શાખા :—

- મહાનગરપાલિકાના દરેક ભાગ—બંગાળીયાની સારસંભાળ
- વૃક્ષો વાવવા તેમજ તેમની સંભાળ રાખવી
- જાહેર જનતાની સુવિધા તેમજ બાળકોના આનંદ પ્રમોદ માટે ગાર્ડન વિ. સંચાલન

(૧૨) યુ.સી.ડી. શાખા :—

- શહેરી ગરીબી રેખા હેઠળના કુટુંબોને રાષ્ટ્રીય સહાય
- વિધવા પેન્શન યોજના
- પછાત વિસ્તારમાં કોમ્યુનીટીના જુદા જુદા વર્ગો જેવા કે શિવાણ કલાસ, મહેંદી, બ્યુટીપાર્લર,
વાનગી હરીફાઈ વિ.ના પ્રોગ્રામો કરવા તેમજ આરોગ્યને લગત પ્રોગ્રામ

(૧૩) આઈ.સી.ડી.એસ. શાખા :—

બાલવિકાસ યોજના અંતર્ગતની સર્વે કામગીરી તેમજ બાળકોના આરોગ્ય તેમજ માતાની તંદુરસ્તી અંગે બાલવિકાસમાં લેવામાં આવે છે.

(૧૪) આરોગ્ય વિભાગ :—

પોલિયો, જાહેર આરોગ્ય, દવાખાના ધ્વારા આરોગ્ય, સાચવણી, જાહેરમાં વેચાણ થતા ખાદ્ય પદાર્થોથી ફેલાતા રોગચાળા સામે યોગ્ય સારવાર તેમજ અરજદાર નાગરીક અથવા તો હોસ્પિટલો તરફથી જન્મ અથવા મરણની નોંધ નિયત ફોર્મમાં રજુ થયે (જરૂરી ફી સાથે) નોંધણી કરી આપવામાં આવે છે તેમજ જન્મ—મરણ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવે છે.

(૧૫) વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ :—

મહાનગરપાલિકા હસ્તકના કુલ ૦૩ (ત્રણ) ફાયર સ્ટેશન છે પુર અને આગ અક્સમાતમાં બચાવની કામગીરી.

(૧૬) અભિનશમન સેવા (ફાયર બ્રિગેડ) :—

મહાનગરપાલિકા હસ્તકના પૂર્વ(વરાધા)ઝોન(એ) વિસ્તારમાં નીચે જણાવેલ કુલ ૦૧ (એક) ફાયર સ્ટેશન કાર્યરત છે. જેના ધ્વારા તમામ આગ અને બચાવની કામગીરી કરવામાં આવે છે.
વરાધા(કાપોડ્રા), સ્પીનીગ મીલ પાસે, વરાધા રોડ, સુરત(ફોન નં.૦૨૬૧-૨૫૭૧૩૮૮)

(૧૭) ગુમાસ્તાધારા / વ્યવસાયવેરા વિભાગ :—

મુંબઈના દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ ૧૯૪૮ માં જણાવ્યા મુજબની તમામ ફરજો બજાવવી જેવી કે, સંસ્થાની નોંધણી થયેલ છે કે કેમ? તેમજ સંસ્થામાં કામ કરતાં કર્મચારીઓનાં હાજરી પત્રક, પગાર પત્રક વિગેરેની તપાસ તેમજ સંસ્થાની અઠવાડિક બંધની તપાસ/રાત્રિ તપાસ કરવી તથા ધારાભંગની નામદાર મ્યુનિ.કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવી.

બોમ્બે લેબર વેલ્ફેર ફંડ અધિનિયમ ૧૮૫૭ની અમલીકરણ કરાવવું.

ગુજરાતના દુકાનો અને સંસ્થાઓના અધિનિયમોના નિયમ જોગવાઈઓનું અમલીકરણ કરાવવું.
કર્મચારી જીવન વીમા અધિનિયમ ૧૯૮૦ની જોગવાઈઓનું પાલન કરાવવું.

ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ ૧૯૭૬ અંતર્ગત સંસ્થાઓ પાસેથી વ્યવસાય વેરોની વસૂલાત કરવી તેમજ કર્મચારીઓના ફણાની વસૂલાત કરવી. નોંધણી પ્રમાણપત્ર રીન્યુ કરવાની કામગીરી કરવી.

(૧૮) કાયદા ખાતું અને એપેલેટ વિભાગ:-

સમગ્ર જોન વિસ્તારની મિલકતો પર આકારણી વિભાગ ધ્વારા જે કરો લેવામાં આવે છે. જે સામે કરપાત્ર વ્યક્તિ ધ્વારા જો કોઈ વાંધા અરજી દાખલ કરવામાં આવે તો તેનો કાયદાકીય તરીકે નિકાલ કરવો.

સમગ્ર જોનની વાદી અથવા પ્રતિવાદી તરીકેની કોઈ મેટરો અંગે જોનનાં લાગત ખાતા સાથે સંકલનમાં રહી કાયદાકીય માર્ગદર્શન, અભિપ્રાય આપવાની કામગીરી કરવામાં આવે છે.

(૧૯) શેદ્ટર હોમ(ઘર વિહોણા લોકો માટે આશ્રય સ્થાન):-

શહેરમાં રહેતા ઘર વિહોણા લોકોને પાણી પુરવઠો, સ્વચ્છતા, સુરક્ષા અને સલામતી જેવી પાયાની આધાર વ્યવસ્થા સહિત કાયમી આશ્રયની સુલભ્યતા સુનિશ્ચયત કરવાનો છે. ઘર વિહોણા લોકોમાં જેમની પાસે પોતાની માલિકીઅથવા ભાડાનું ઘર નથી, જે ખુલ્લા આકાશ નીચે અથવા માનવ વસવાટ માટે અયોગ્ય એવી જગ્યાઓ જેવીકે ફુટપાથ, બગીચા, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધર્મિક સ્થળો, કારખાનાં, દુકાન બહાર અથવા બાંધકામનાં સ્થળો ઉપર સુવે છે. રાત્રી દરમ્યાન કરતાં કે છૂટક મંજૂરી કરતાં લોકો કે જેમને માત્ર રાત્રે જ નહીં પરંતુ દિવસ દરમ્યાન પણ આવાસની જરૂરીયાત રહે છે. એવા લોકોનો આ યોજના અંતર્ગત સમાવેશ થાય છે.

૧.૭ જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ :

સુરત મહાનગરપાલિકા ધ્વારા જાહેર તંત્રના થતા કામો જેવા કે સફાઈ વ્યવસ્થા, લાઈટીંગ વ્યવસ્થા, પાણી વિતરણ વ્યવસ્થા, રાહતકાયો, કુદરતી આફતો વિ. માટે લોકો દરેક કાર્યને પોતાના હિતનું સમજે અને શહેર સુશોભિત રહે તેવી લાગણીથી કામને સમજે તેવી જાહેર તંત્ર લોકો પાસે અપેક્ષા રાખે છે.

૧.૮ લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પદ્ધતિઓ :

પાણીવેરો, મકાનવેરો, અન્ય વેરાઓ તથા જકાતવેરો લોકોને જે લાગુ પડે છે તે સમયસર ભરપાઈ કરવામાં આવે તો જાહેરતંત્ર વિકાસનું આયોજન કરી શકે તેમજ જાહેર જનતા ધ્વારા શહેરમાં લોકભાગીદારીથી વિકાસના કામો કરવા સહયોગ મેળવવો જોઈએ. તેમાં જાહેર સંસ્થાઓ, એસોશીએશનો, કુલબો તથા સેવા ટ્રસ્ટો ધ્વારા કાર્યો કરાવવા વિ. પદ્ધતિથી સહયોગ મેળવવા જોઈએ.

૧.૯ સેવા આપવાના દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર સરકારશી ધ્વારા તથા સુરત મહાનગરપાલિકા ધ્વારા નાગરીક અધિકાર પત્ર કાર્યક્રમ મુજબ નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે તંત્ર ઉપલબ્ધ

૧.૧૦

કચેરી શરૂ થવાનો સમય : ૧૦.૩૦ કલાકે સવારે

કચેરી રીશેષનો સમય : ૨.૩૦ થી ૩.૦૦ કલાક

કચેરી બંધ થવાનો સમય : ૬.૧૦ કલાકે સાંજે

મુદ્રા નં.૦૨ :— સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો :—

પૂર્વ(વરાણ)ઝોન(એ) સુરત મહાનગરપાલિકા

| હોદ્દો | જોબ ચાર્ટ/કામગીરીની વિગત |
|------------------------|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| જોનલ ચીફ | <ul style="list-style-type: none"> — જોનલ ચીફ તરીકે સમગ્ર જોનને નેતૃત્વ પુરુષ પાડવું. તેમજ તાબા હેઠળના અધિકારી/કર્મચારીઓ પાસેથી ઈસ્ટઝોન (એ) ને લગતી તમામ પ્રકારની કામગીરીની દેખરેખ રાખી માર્ગદર્શન પુરુષ પાડવું. — જોનના જોનલ ચીફ તરીકે તેઓને વહીવટી સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે. |
| આસીસ્ટન્ટ કમિશનર | <ul style="list-style-type: none"> — વહીવટી વિભાગનાં વડા તરીકે ફરજ બજાવવી, જેમાં જોનના ઈજનેરી વિભાગ સિવાયની તમામ વિભાગ જેવા કે, આકારણી વિભાગ, પ્રોફેશનલ ટેક્સ કાયદા/એપેલેટ વિભાગ, સામાન્ય વહીવટી વિભાગ, ગુમાસ્તાધારા વિભાગ, હિસાબી વિભાગની તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તાબા હેઠળનાં સ્ટાફ મારફત કામગીરી કરાવવી. તેમજ આર.ટી.આઈ.એક્ટ હેઠળ અપીલ અધિકારીની સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે. |
| કાર્યપાલક ઈજનેર | <ul style="list-style-type: none"> — જોનના ઈજનેરી વિભાગના વડા તરીકેની ફરજ બજાવવી, જેમાં જોનના ઈજનેરી વિભાગની તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તાબા હેઠળનાં સ્ટાફ મારફત કામગીરી કરાવવી. જોનના કાર્યપાલક ઈજનેર તરીકે તેઓને વહીવટી તેમજ આર.ટી.આઈ. એક્ટ હેઠળ અપીલ અધિકારીની સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે. — પુરુષ કે અન્ય કુદરતી આફિલ વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી. |
| નાયબ આરોગ્ય અધિકારી | <ul style="list-style-type: none"> — સમગ્ર જોનમાં આરોગ્યલક્ષી કામગીરીઓ અંગે તમામ વોર્ડ તથા વાહકજન્ય રોગ નિયંત્રણ યુનિટની કામગીરીનું સુપરવિઝન અને વહીવટી કામગીરી. — પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ. — આરોગ્ય લક્ષી બાબતોને લાગત ટેકનીકલ કામગીરીઓનું સંકલન — સાઇસફાઇની કામગીરી — જંતુનાશક દવાઓનો છંટકાવ — ઘન કચરાનું એકન્ટ્રિકરણ, પરિવહન અને આખરી નિકાલ — મરેલા જાનવરો (નાના અને મોટા) નો નિકાલ — પી.એફ.એ.એક્ટ ૧૮૫૪ હેઠળ ખાદી પદાર્થોના તથા માર્કેટ વિભાગના લાયસન્સ રીન્યુઅલની કામગીરી — ગલી-ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી — ખાળકુવા સફાઈ, જાજરૂ સફાઈ, ગલી સફાઈ — વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ — ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા ખાણી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી — જાહેર જાજરૂ/પિશાબદાનીની સફાઈ ની કામગીરી |

મુદ્રા નં.૦૨ :-

કલમ-૪(૧)(ખ)(૨):— સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો:-

ટેક્નીકલ વિભાગ

| અ. નં. | હોદ્દો | જોબ ચાર્ટ / કામગીરીની વિગત |
|--------|-----------------------------------------------------------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| (૧) | ડે. ઈજનેર | <ul style="list-style-type: none"> — સબ જોન વિસ્તારમાં કાર્યક્ષેત્ર હેઠળનાં તમામ આસી. /જુની.ઈજનેરોને સૌંપવામાં આવેલ વિવિધ ખાતાઓને લગતી કામગીરીનું સુપરવિઝન તેમજ સંકલનની કામગીરી. — વધુમાં કાર્યપાલક ઈજનેરશ્રી તરફથી મળતાં કોમન કામો, દાખલા તરીકે સ્વર્ણિમ ગુજરાત યોજનાનેલગતી કામગીરી. — નવરાત્રીને લગતા જાહેર કામો રેલ રાહતને લગતા કામો તથા કુદરતી આપત્તિ વેળાએ સલામત દુરસ્તીની કામગીરી. — ટેક્નીકલ ખાતાના કર્મચારીઓનું અઠવાડિક ચેકીગની કામગીરી. — પોતાના હાથ નીચેનાં કર્મચારી / કામદારની કામગીરી નું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ. — ટેક્નીકલ વિભાગને લગતી આર.ટી.આઈ.નાં જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી. |
| (૨) | આસી.ટાઉન પ્લાનર | <ul style="list-style-type: none"> — સમગ્ર જોન વિસ્તારમાં સમાવિષ્ટ ટી.પી. સ્કીમોના આઈ.સી.ના નાણાની રીકવરીને લગતી કામગીરી. — સમગ્ર જોન વિસ્તારમાં જાહેરાતના બોર્ડ /હોર્ડિંગસને લગતી કામગીરી. — સમગ્ર જોન વિસ્તારમાં ટેલીકોમ્યુનિકેશન ટાવરને લગતી કામગીરી. — સમગ્ર જોન વિસ્તારમાં જુદા જુદા રસ્તાઓ ચોક વગેરેનાં નામકરણની કામગીરી. |
| (૩) | શહેર વિકાસ વિભાગ :— આસી./ જુની. ઈજનેર/ સુપરવાઈઝર | <ul style="list-style-type: none"> — ઈસ્ટઝોન વરાધા(એ)વિસ્તારમાં વિકાસ પરવાનગીની ફાઈલો મંજૂર કરવી, — સમયાંતરે મુખ્ય કચેરી, સરકારી તથા અન્ય કચેરીએથી માંગવામાં આવતી માહિતી આપવી, — ગેરકાયદેસર બાંધકામને નોટીસ આપી, તોડવા, — મંજૂર પ્લાન મુજબ — માર્ગદર્શન, — ટેમ્પરરી સ્ટ્રક્ચરો — (મેળા, ફટાકડા, જાહુગર, લેબર કેમ્પ) ને મંજૂરી આપવી, — આરટીઆઈ અર્થગત માહિતી તૈયાર કરી આપવી, — સેલ્યુલર ટાવરની મંજૂરી આપવા અંગેની કાર્યવાહી ભયજનક / બિસમાર મિલ્કતોને આઈડેન્ટીફાઈ કરી, નોટીસ આપી, ઉતારી લેવાની કામગીરી, — B.U.C. આપવાની કામગીરી, — RTI અને APIO ની કામગીરી <p>ટી.પી. સ્કીમનું અમલીકરણ:-</p> <ul style="list-style-type: none"> — રોડ, રસ્તાનું ડીમાર્કેશન — ટાઉન પ્લાનીગ એક્ટ મુજબ નોટીસ આપી રસ્તાનો કબજો મેળવવો, — રીજર્વેશન પ્લોટની સાચવણી, ડીમાર્કેશન, બોર્ડ મારવા, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવી, — ડેવલપમેન્ટનાં રીજર્વેશન પ્લોટમાં દબાણ / ગેરકાયદેસર બાંધકામ ન થાય તેનાં પગલાં લેવા, — ઈમ્પેક્ટ ફી ની વસુલાત, C.O.R. આપવા, — I.C. નાં નાણાની વસુલાત — લારી—ગલ્વા દબાણ દુર કરવા, — જાહેર જનતાની વિવિધ મિલ્કતોની ટાઉન પ્લાનીગ તથા શહેર વિકાસને લગતા મુદ્રાઓની પુછતાછનો નિકાલ, પ્રિવીમનરી/ફાયનલ ટી.પી. સ્કીમનાં રીજર્વ પ્લોટમાં દબાણકર્તાઓની વ્યક્તિગત નોટીસ તૈયાર કરી, રીજર્વ પ્લોટનાં કબજા મેળવવાની કાર્યવાહી. — પોલીસ ચોકી, પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક, પીકઅપ સ્ટેન્ડનાં લોકેશન—ડીમાર્કેટ કરવા. — પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન — હાજરી નિયંત્રણ. |

| | | |
|-----|----------------------------------------------------------------------------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| (૪) | રસ્તા વિભાગ:- આસી. / જુની.ઈજનેર | <ul style="list-style-type: none"> - નવા રસ્તા મેટલ ગ્રાંડિટીંગ, કારપેટ / રીકારપેટ કરવાના કામનાં અંદાજ તૈયાર કરવા, ટેન્ડર કામગીરી તથા સ્થળ પર રસ્તા બનાવવાનાં કામનું સુપરવિઝન. - હયાત રસ્તાનાં મરામત / નિભાવની કામગીરી. - નવા ફુટપાથ બનાવવાનાં અંદાજ / ટેન્ડરની કામગીરી તથા સુપરવિઝન. - રોડ મટીરીયલ્સ સપ્લાયની કામગીરી - આવેલ ફરિયાદનાં તુમારનાં નિકાલની કામગીરી - થયેલ કામોનાં બીલ બનાવવા, ઓડિટ ઓફ્ઝેક્શનનાં નિકાલની કામગીરી - વોર્ડ સમિતિને લગતી કામગીરી - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી/ કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન - હાજરી નિયંત્રણ. - તૈયાર થયેલ રસ્તા પર લેન માર્ક, થમોપ્લાસ્ટ પેઇન્ટ, કેટઆઈ, બોલોર્ડ, જીબ્રા કોસીંગ, સાઈનેજીસની કામગીરી |
| | ટેકનીકલ આસી. / રોડ ઈન્સ્પેક્ટર | <ul style="list-style-type: none"> - ઝોનમાં આવેલ સોંપવામાં આવેલ વિસ્તાર વાઈજ રસ્તા / ફુટપાથ પર ષેપીંગ કરવા તથા માટીનાં ઢગલા ઉપાડવાની કામગીરી. - રસ્તા મેઈન્ટેનન્સ / પેચવર્ક કરવાની કામગીરી. - વરસાદી જાળીયા સફાઈ કામગીરી, ફુટપાથ રીપેરીંગ કરવાનીકામગીરી, ખુલ્લી ગટર, ફાડચા સફાઈની કામગીરી, રસ્તા સાઈડ પરનાં જંગલ કટીગની કામગીરી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ. - સીમેન્ટ / ડામર વિગેરેનાં વપરાશ તથા રજીસ્ટર મેઈન્ટેઇન કરવાની કામગીરી. |
| (૫) | પાણી વિભાગ :- આસી./જુની.ઈજનેર / સુપરવાઈઝર | <ul style="list-style-type: none"> - ઝોન વિસ્તારનાં સોસાયટી, લુંપડપટ્ટી વિસ્તારમાં - લીકેજ દુરસ્ત તેમજ ગંદા પાણીના નિકાલની - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન - હાજરીનિયંત્રણ. - RTI અને APIO ની કામગીરી |
| | ટેકનીકલ આસી. | <ul style="list-style-type: none"> - લીકેજ દુરસ્ત તેમજ ગંદા પાણીને લગતી કામોની કામગીરી - પાણીનાં નવા નળ કનેક્શનો / ફી કનેક્શનો આપવાની કામગીરી - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ. - સ્ટોરમાંથી લાવવામાં આવેલ મટીરીયલ્સની દેખરેખ તથા રજીસ્ટર મેઈન્ટેઇન કરવાની કામગીરી |
| | લીકેજ ઈન્સ્પેક્ટર/ ફીટર ઈન્સ્પેક્ટર (ત્રીજી શ્રેણી કલાર્ક) | <ul style="list-style-type: none"> - લીક વિઝીટ દરમ્યાન લીકેજ તથા ગંદા પાણીને લગતી મળેલ ફીયાદ સંદર્ભે દુરસ્તી તેમજ ગંદા પાણી ને લગતી કામગીરી પૂર્ણ કરી ફીયાદનો નિકાલ કરવો. - નવા નળ / ફી કનેક્શન આપવાની કામગીરી - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ. |
| (૬) | હાઉસીંગ વિભાગ આસી. / જુની. ઈજનેર/ સુપરવાઈઝર | <ul style="list-style-type: none"> - અંદાજ બનાવવાની કામગીરી, ટેન્ડર ની કામગીરી, ચાલુ કામો પર દેખરેખ, સુરત મહાનગરપાલિકાની માલિકીની મિલકતોની નિભાવનીકામગીરી - કાગળોનાં પત્રવ્યવહારની કામગીરી - રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી - પ્રસંગોની ઉજવણીમાં જરૂરી વ્યવસ્થા કરવાનીકામગીરી - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ/ સુપરવિઝન - હાજરી નિયંત્રણ. - ગાર્ડન મેઈન્ટેનસની કામગીરી |

| | | |
|-----|--------------------------------------------------------------------------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| | ટેક્નીકલ આસી. | <ul style="list-style-type: none"> - ચાલુ કામોની સાઈડ પર દેખરેખ - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ. - સીમેન્ટ, સ્ટીલ તથા અન્ય મટીરીયલ્સના વપરાશ તથા રજીસ્ટર મેઇનટેઇન કરવાની કામગીરી. |
| (૭) | ડ્રેનેજ વિભાગ આસી. / જુની. ઈજનેર /સુપરવાઈઝર | <ul style="list-style-type: none"> - સમગ્ર જોન વિસ્તારનાં સ્ટ્રોમ રેઇન લાઈનોનાં અંદાજો બનાવવા - ટેન્ડરો મંગાવવા, મંજૂર કરવવા, કોન્ટ્રાક્ટ સૌંપી સ્થળ કામગીરીનું સુપરવિઝન, માપણી, રનીગ તથા ફાઈનલ બીલો બનાવવા, સમગ્ર જોન વિસ્તારમાં મિલ્કતોની ડ્રેનેજ કનેક્શનની મંજૂરી આપવી, ઓડીટ - RTI અને APIO ની કામગીરી - સીક્યુરેટી ડિપોઝિટ છુટી કરવા સુધીની તમામ કાર્યવાહી કરવાનું તમામ પ્રકારની માહિતી આપવાનું, આ તમામ સ્ટોર્મ તથા સુઅર રેઇન લાઈનોનાં મરામત નિભાવની કામગીરી જેવી કે રીપેરીંગ, લાઈનોની સાફ્ટસફાઇચર (ડિસલ્ટીંગ), રીવર ફ્લડ ગેટોનાં ઓપરેશન મેઇનન્ટેનન્સની કામગીરી, ડિવોટરીંગ પંપો ચલાવવાની કામગીરી નિભાવણીની કામગીરી, જાળીયા તથા મેનહોલ ખરીદવા વિગેરે તમામ કામગીરી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ / સુપરવિઝન તથા હાજરી નિયંત્રણ |
| | ટેક્નીકલ આસી. | <ul style="list-style-type: none"> - સાઈડ પર સ્ટોર્મ / સુઅર લાઈનોનાં કામગીરી પર સુપરવિઝન - સીમેન્ટ તથા અન્ય મટીરીયલ્સ નું સ્ટોક રજીસ્ટર બનાવવાની કામગીરી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ. - સીમેન્ટ તથા અન્ય મટીરીયલ્સના વપરાશના રજીસ્ટર મેઇનટેઇન કરવાની કામગીરી. |
| (૮) | લાઈટ વિભાગ આસી./ જુની. ઈજનેર (ઈલે.) | <ul style="list-style-type: none"> - સમગ્ર જોન વિસ્તારની સ્ટ્રીટ લાઈટોની મરામત, નિભાવની કામગીરીનું દેખરેખ તથા નવા સ્ટ્રીટલાઈટ પોલ ઉભા કરવાના કામે અંદાજો રજૂ કરાવવા. - કોન્ટ્રાક્ટથી સૌંપી સ્થળ ઉપર સુપરવિઝન તથા એનજીરી બીલોની ચૂકવણી તથા મ્યુ. મિલ્કતો નાં મરામત નિભાવ સહિતની તમામ લાઈટ ખાતાની કામગીરી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર ની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન - હાજરી નિયંત્રણ. |
| | ઈલે. સુપરવાઈઝર | <ul style="list-style-type: none"> - સ્ટ્રીટ લાઈટ મરામત - નિભાવની કામગીરીનું સુપરવિઝન, ટી. પી. રસ્તા ઉપર નવા સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવાના કામે અંદાજ બનાવી જે તે સ્ટ્રીટ લાઈટ પોલ ઉભા કરવાની કામગીરીનું સુપરવિઝન સહિતની કામગીરી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી / હાજરી / વર્તણૂંક બાબતે અસરકારક સુપરવિઝનની કામગીરી તથા હાજરી નિયંત્રણ |
| (૯) | મેઇનન્ટેનન્સ આસી. (ઈલે.) | <ul style="list-style-type: none"> - ઈસ્ટર્ઝોન (વરાઇંગ) (એ) વિસ્તારમાં આવેલ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવાની કામગીરી તથા સુપર વિઝન તથા હાઉસીંગ મેઇનન્ટેનન્સ, સ્ટોક મેઇનન્ટેનન્સ સહિતની કામગીરી સુપરવિઝનની કામગીરી - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી / હાજરી / વર્તણૂંક બાબતે અસરકારક સુપરવિઝનની કામગીરી - હાજરી નિયંત્રણ |
| | વાયરમેન | <ul style="list-style-type: none"> - સ્ટ્રીટ લાઈટ મેઇનન્ટેનન્સનાં કામે રાત્રે ચેકીંગની કામગીરી - મ્યુ. મિલ્કતોમાં મરામત / વાયરીંગને લગતી કામગીરી - ટોરેન્ટ / DGVCL સાથે સંકલનની કામગીરી – તથા અન્ય ખાતા તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી. |
| (૯) | દ્વાષાણ વિભાગ આસી./જુની. ઈજનેર/ સુપરવાઈઝર/ ટેક્નીકલ આસી. | <ul style="list-style-type: none"> - જાહેર રસ્તા પરનાં દ્વાષાણ દુર કરવાની તથા શહેર વિકાસ ખાતા માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કામગીરી તથા અધિકારીશ્રીઓની સુચનાઓનું વખતોવખત પાલન કરવાની કામગીરી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ. - દ્વાષાણ ખાતા ધ્વારા જમા કરવામાં આવતા માલ-સામાન રજીસ્ટર નીભાવાની કામગીરી. |

આરોગ્ય તથા વી. બી. ડી. સી. વિભાગ

| | |
|-----------------------------|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| | <ul style="list-style-type: none"> - સમગ્ર ઝોનમાં આરોગ્યલક્ષી કામગીરીઓ અંગે તમામ વોર્ડ તથાવાહક જનિત રોગ નિયંત્રણ યુનિટની કામગીરીનું સુપરવિઝન અને વહીવટી કામગીરી. - પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ. - આરોગ્ય લક્ષી બાબતોને લાગત ટેક્નીકલ કામગીરીઓનું સંકલન - સાફ સફાઈની કામગીરી - જંતુનાશક દવાઓનો છંટકાવ - ઘન કચરાનું એક્ટ્રિકરણ, પરિવહન અને આખરી નિકાલ - મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલ - પી.એફ.એ.એક્ટ ૧૯૮૪ હેઠળ ખાદ્ય પદાર્થોના તથા માર્કેટ વિભાગના લાયસન્સ રીન્યુઅલની કામગીરી - ગટરલાઈન ચોકીંગ તથા મેનહોલ ચોકીંગ, ડીસીલ્ટીંગ વિગેરે કામગીરી - ગલી-ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી - ખાળકુવા સફાઈ, જાજરૂ સફાઈ, ગલી સફાઈ |
| નાયબ આરોગ્ય અધિકારી | <ul style="list-style-type: none"> - વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ - ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા ખાણી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી - જાહેર જાજરૂ/પિશાબદાનીની સફાઈ ની કામગીરી - જાહેર મનોરંજનના સ્થળો જેવા કે સિનેમા, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ - રોગ ચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીકે જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી. - ઈ- ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળના અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી. - નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી તેમજ એન્જીનિયરીંગને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા - નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકાર પત્ર - વહીવટી સરળતા અને કોમ્પ્યુનિકેશન નેટવર્ક માટે સતત કાર્યરત રહેતા ઉદ્દેશ વાયરલેસ સેટ - દરેક વોર્ડ વાઈઝ રોજ રોજ પાણીનાં નમુના બેકટોરીયોલોજીકલ / કેમ્બીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વીકરણ કરી ગંદા પાણીની ફરિયાદોની ૨૪ કલાકમાં નિકાલ કરવાની વિશિષ્ટ પ્રથા - સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની કામગીરી. - આર.ટી.આઈ.એક્ટ હેઠળ અપીલ અધિકારીની સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે. |
| આસી. જંતુનાશક અધિકારી | <ul style="list-style-type: none"> - સમગ્ર ઝોન વિસ્તારમાં વાહક જનિત રોગ નિયંત્રણ અંગેની કામગીરીનું મોનીટરીંગ તેમજ સુપરવિઝન - પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ. - વી.બી.ડી.સી.વિભાગને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી. |
| ચીફ એસ. આઈ. | <ul style="list-style-type: none"> - સમગ્ર ઝોન વિસ્તારમાં આરોગ્યલક્ષી તમામ કામગીરી કરાવવાની. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ/સુપરવિઝન - હાજરી નિયંત્રણ. - સાફ સફાઈની કામગીરી - જંતુનાશક દવાઓનો છંટકાવ - ઘન કચરાનું એક્ટ્રિકરણ, પરિવહન અને આખરી નિકાલ - મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલ - પી.એફ.એ.એક્ટ ૧૯૮૪ હેઠળ ખાદ્ય પદાર્થોના તથા માર્કેટ વિભાગના લાયસન્સ રીન્યુઅલની કામગીરી - ગલી-ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી - ખાળકુવા સફાઈ, જાજરૂ સફાઈ, ગલી સફાઈ, વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા - ખાણી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી જાહેર જાજરૂ / પિશાબદાનીની સફાઈ ની કામગીરી - જાહેર મનોરંજનના સ્થળો જેવા કે સિનેમા, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ - રોગ ચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીકે જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી. - ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળના અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી. - નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી તેમજ એન્જીનિયરીંગને લગતી ફરિયાદોની |

| | |
|------------------------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| | <p>૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા</p> <ul style="list-style-type: none"> - નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકાર પત્ર. |
| ચીફ એસ. આઈ. | <ul style="list-style-type: none"> - વહીવટી સરળતા અને કોમ્પ્યુનિકેશન નેટવર્ક માટે સતત કાર્યરત રહેતા ઉદ્ઘાટ વાયરલેસ સેટ - દરેક વોર્ડ વાઈજ રોજ રોજ પાણીનાં નમુના બેકટોરીયોલોજીકલ / કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વીકરણ કરી ગંદા પાણીની ફરિયાદોની ૨૪ કલાકમાં નિકાલ કરવાની વિશિષ્ટ પ્રથા. - આરોગ્ય વિભાગ ને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી. |
| આરોગ્ય નિરીક્ષક | <ul style="list-style-type: none"> - આરોગ્યલક્ષી તમામ કામગીરી કરાવવાની તથા યુનીટ ખાતેનાં કર્મચારીઓ પાસે તમામ પ્રકારની કામગીરી કરાવવાની, રાત્રિ છેપીંગ/બ્રશીંગ કામગીરીનું સુપરવિઝન તેમજ વહીવટી કામગીરી - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન - હાજરી નિયંત્રણ - સાફ સફાઈની કામગીરી - જંતુનાશક દવાઓનો છંટકાવ - ઘન કચરાનું એકત્રિકરણ, પરિવહન અને આખરી નિકાલ - મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલ - પી.એફ.એ.એક્ટ ૧૯૮૪ હેઠળ ખાંડ પદાર્થોના લાઈસન્સ તથા માર્કેટ વિભાગના લાયસન્સ રીન્યુઅલની કામગીરી - ગલી-ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી - ખાળકુવા સફાઈ, જાજરૂ સફાઈ, ગલી સફાઈ - વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ - ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા - ખાણી પીણીની હોટેલ, લારી ગલ્વા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી - જાહેર જાજરૂ/પિશાબદાની સફાઈ ની કામગીરી - જાહેર મનોરંજનના સ્થળો જેવા કે સિનેમા, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ - રોગ ચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીકે જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી. - ઈ- ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળના અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી. - નાગરિક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી તેમજ એન્જીનિયરીને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા - નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકાર પત્ર - વહીવટી સરળતા અને કોમ્પ્યુનિકેશન નેટવર્ક માટે સતત કાર્યરત રહેતા ઉદ્ઘાટ વાયરલેસ સેટ - દરેક વોર્ડ વાઈજ રોજ રોજ પાણીનાં નમુના બેકટોરીયોલોજીકલ / કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વીકરણ કરી ગંદા પાણીની ફરિયાદોની ૨૪ કલાકમાં નિકાલ કરવાની વિશિષ્ટ પ્રથા |
| મદદનીશ આરોગ્ય નિરીક્ષક | <ul style="list-style-type: none"> - આરોગ્યલક્ષી તમામ કામગીરી તેમજ એ. આઈ.એ. શ્રી તેમજ સેનેટરી ઈન્સ્પેક્ટરોનાં સલાહ સુચન મુજબ તમામ પ્રકારની કામગીરી, પ્રાયમરી હેઠ્થ વર્કર તથા બેલદાર પાસે લેવી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ |
| પ્રાયમરી હેઠ્થ વર્કર | <ul style="list-style-type: none"> - ઈન્ટ્રો. સર્વેલન્સ અંગેની કામગીરી તથા એન્ટીલાર્વલ અંગેની કામગીરી, ફોંગીંગ અંગેની કામગીરી. |
| મુકાદમ | <ul style="list-style-type: none"> - આરોગ્યલક્ષી તમામ કામગીરી |

વહીવટી વિભાગ

| | |
|------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફિસર | <ul style="list-style-type: none"> - સુરત મહાનગરપાલિકાનાં વિસ્તારમાં આવેલ મિલ્કતોની આકારણી દફ્તરે વેરાનાં હેતુ માટે એસેસમેન્ટ કરી ખાસ નોટીસ બજાવવી તથા નોંધણી કરવી. - આવી મિલ્કતો માટેનું એસેસમેન્ટ રજીસ્ટર, કટબુક રજીસ્ટર તથા તેને આનુસાંગિક અન્ય રેકર્ડની જાળવણી કરવી/ કરાવવી. - મિલ્કતોની આકારણી થયા બાદ તેના યોગ્ય તે સમયે વેરા માટેનાં બીલો તૈયાર કરવા તથા તે ખૂનીસીપલ વેરાની રીકવરી કરવી. - ધી બી.પી. એમ.સી. એકટ મુજબ જો વેરાની વસુલાત ન થાય તો નક્કી કરેલ સમય મર્યાદામાં નોટીસ, વોરંટ બજાવી ત્યાર બાદ, યોગ્ય તે સમયે તેવી મિલ્કતોને જપ્તીમાં લઈ વેરા વસુલાતની આગળની કાર્યવાહી કરવી. - દર એપ્રિલ માસમાં તમામ મિલ્કતોની થયેલ આકારણીનું રજીસ્ટર જાહેર જનતા માટે ખુલ્લાં મુકવું અને તેમાં આવેલ વાંધાઓ એપેલેટ ઓફિસર ધ્વારા સંભળાવવાની વ્યવસ્થા કરવી. - થયેલ એપેલેટનાં હુકમનો અમલ કરવો. તેની ખાસ નોટીસ બજાવવી. - વખતોવખત મિલ્કતોનાં માલિકો, ધારણકર્તાઓ, કબજેદારનાં નામ રજુ કરેલ દસ્તાવેજી પુરાવાઓને આવિન આકારણી દફ્તરે ફેરફાર કરવા. - અરજાદાર તરફથી આવતી નવી મિલ્કત માટેની આકારણી કરવાનાં હેતુ સારુ આવતી અરજીઓ સ્વીકારી તેવી નવી / ફેરફાર થયેલ મિલ્કતોની આકારણી કરી આકારણી દફ્તરે ચઠાવી તેની રીવાઈઝ નોટીસ આપી બીલ ઈસ્પુ કરવા. - શેલ્ટર હોમની વહીવટી કામગીરી. - આકારણી વિભાગને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી. |
| પસોનેલ ઓફિસર | <ul style="list-style-type: none"> - સમગ્ર જોનનો વહીવટ સુગમ અને સરળ રીતે ચાલે તે જોવાની જવાબદારી, - સમગ્ર જોનનાં વહીવટી અધિકારી તરીકેની કામગીરી, - આંતરીક ખાતાકીય તપાસને લગતી તમામ કામગીરી, - કર્મચારીઓ નિયમીત હાજર રહે તે જોવાની તથા વખતોવખત હાજરીપત્રક ચેક કરવાની કામગીરી, ફીલ્ડ ડયુટી ઉપર ફીઝીકલ હાજરી ચેક કરવાની કામગીરી, - મહેકમને લગતી તમામ કામગીરી. - પોતાના હાથ નીચેના કર્મચારી/કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ. - મહેકમ વિભાગને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી. |
| આસી.લો. ઓફિસર | <ul style="list-style-type: none"> - સુ.મ.પા.ના કાયદા ખાતા ધ્વારા જ્યારે જ્યારે પણ પ્રવર્તમાન કાયદાઓ માં સુધારો થાય ત્યારે સુધારેલ કાયદાઓના પુસ્તકો કાનુની પુસ્તકાલયથી ખરીદવાની કાર્યવાહી. - સુ.મ.પા. ધ્વારા બનાવવામાં આવેલ એડવોકેટોની પેનલ યાદી માટે સ્થાયી સમિતિએ નક્કી કરેલ ફી માં સુધારા—વધારા માટે જરૂરી કાર્યવાહી. - મ્યુ.કોટમાં સુ.મ.પા. તરફથી દાખલ કરવામાં આવતા કેસોમાં મહાનગર પાલિકા વતી હાજર રહી રજૂઆત કરવાનો તેવો કેસો નો નિકાલ થયે હુકમત ધરાવતી અદાલતમાં અપીલ કરવાજોગ છે કે કેમ ? તે બાબતે કાનુની અભિપ્રાય આપવાની કામગીરી. - વિવિધ અદાલતોમાં કર્મચારીના કેસો માટે પેનલ એડવોકેટની નિમણૂંકનો અભિપ્રાય, ફી બાબતે વ્યાજભીપણાનો અભિપ્રાય તેમજ વહીવટી રીતે કર્મચારીઓના કેસો તેમજ કાનુની મુદ્દાનો અભિપ્રાય આપવાની કામગીરી. - કાયદા વિભાગને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી. - એપેલેટ અધિકારી તરીકે હરકત અરજી ની સુનાવણી કરી તેના નિર્ણય આપવા. |
| ૩. એકાઉન્ટન્ટ | <ul style="list-style-type: none"> - હિસાબીને લગતી તમામ કામગીરી, - બજેટ, જનરલ એડવાન્સ, ડિપોઝીટ, આવક— ખર્ચને લગતી તમામ કામગીરી, - ઓડિટ ઓફિશનનો નિકાલ, - રીકુપ્મેન્ટની કામગીરી, - ઇન્ઝીનેન્ટનાં અભિપ્રાયની કામગીરી. - પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ - એકાઉન્ટન વિભાગને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી. |
| સેક્શન ઓફિસર | <ul style="list-style-type: none"> - કર્મચારીઓ નિયમીત ફરજ પર હાજર રહે છે કે નહિ તે બાબત. - તાબા હેઠળનાં કર્મચારીઓ પાસેથી લેવાની કામગીરી, - ગર્વમેન્ટ તરફથી માંગ્યા મુજબની માહિતી નિયમીત જાય છે કે નહિ તે જોવું, - સેક્શનમાં દરેક દફ્તરોને લગતી જવાબદારી તથા અન્ય સુપરવાઈઝ પ્રકારની કામગીરી, - મહેકમને લગતી તમામ કામગીરી, - જોનનાં વહીવટને લગતી કામગીરી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી/કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન |

| | |
|--------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| | <ul style="list-style-type: none"> - હાજરી નિયંત્રણ. |
| જમીન મિલક્ત વિભાગ સેક્શન ઓફિસર (વહીવટી) | <ul style="list-style-type: none"> - જુદા જુદા શોપીંગ સેન્ટર્સના ભાડા વસુલ કરવાની કામગીરી - મ્યુ. ટેનામેન્ટનાં હપ્તા વસુલાત કરવાની કામગીરી - મહાનગરપાલિકાનાં જમીનો કામચારાઈ ભાડે આપવાની તથા તેનું ભાડું વસુલ કરવાની કામગીરી તથા જમીનમિલક્તને લગતી તમામ કામગીરી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન - હાજરી નિયંત્રણ. |
| દુકાનધારા નિરીક્ષક | <ul style="list-style-type: none"> - મુંબઈના દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ ૧૯૪૮ માં જણાવ્યા મુજબની તમામ ફરજો બજાવવી જેવી કે, સંસ્થાની નોંધણી થયેલ છે કે કેમ? તેમજ સંસ્થામાં કામ કરતાં કર્મચારીઓનાં હાજરી પત્રક, પગાર પત્રક વિગેરેની તપાસ તેમજ સંસ્થાની અઠવાડિક બંધની તપાસ/રાત્રિ તપાસ કરવી તથા ધારા ભંગની નામદાર મ્યુનિ. કોર્ટમાં ફરિયાદ દાખલ કરવી. - કર્મચારી જીવનવીમા અધિનિયમ ૧૯૮૦ની જોગવાઈઓનું પાલનકરાવવું. - બોખે લેબર વેલફર ફંડ અધિનિયમ ૧૯૫૩ ની અમલીકરણકરાવવું. - ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ ૧૯૭૯. - વધુમાં, વ્યવસાય વેરાને લગતી તમામ કામગીરી તથા વ્યવસાય વેરા / ગુમાસ્તાધારાની સાથે સંકળાયેલા સ્ટાફની કામગીરી પર સુપરવિઝન કરવું. - ગુમાસ્તા વિભાગને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી. |
| પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક | <ul style="list-style-type: none"> - ઓડિટ ઓફ્ઝેક્શનનો નિકાલ કરવાની કામગીરી, - જનરલ એડવાન્સ, રીકુપમેન્ટની કામગીરી, - સ્ટોર ડિપોઝિટ એકાઉન્ટ રીકુપમેન્ટની કામગીરી, - આ કામગીરી જે તે ખાતાવાર અલગ અલગ પ્રકારની આ ઉપરાંત ખાતાનાં વડા અધિકારી સોંપે તે કામગીરી કરવાની રહે છે. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી ની કામગીરી / હાજરી / વર્તણૂંક બાબતે અસરકારક સુપરવિઝનની કામગીરી તથા હાજરી નિયંત્રણ - RTI સંદર્ભે APIO ની કામગીરી |
| બીજી શ્રેષ્ઠી કલાર્ક— સીનીપર કલાર્ક | <ul style="list-style-type: none"> - જે તે ખાતામાં સોંપવામાં આવતી ખાસ પ્રકારની જવાબદારીઓ જેવી કે, હિસાબી શાખામાં બીલ બનાવવાની, બીલ ચેકીંગ ૧૦૦ %, તેમજ અન્ય પ્રકારની ખાતા તરફથી સોંપવામાં આવતી કામગીરી, સભ્યશ્રીઓ તરફથી સ્ટેન્ડીંગ કમીટી, સામાન્ય સભામાં પુછવામાં આવતા સવાલોનાં જવાબો તૈયાર કરવાની કામગીરી. આમ, દરેક ખાતા પ્રમાણે કામગીરીમાં ફેરફાર રહે છે, - તદૃપરાંત કેશ કાઉન્ટરની કામગીરી, - ટે બુક, રીટર્ન ચેક, શિક્ષણ ઉપકર, કુરીયરની કામગીરી, - સર્વેયરની કામગીરી, તુમાર તૈયાર કરવા - સ્ટોર વિભાગની કામગીરી, - રાઇટ ટૂ ઇન્ફર્મેશન સેલને લગતી કામગીરી - ગુમાસ્તા વિભાગ / પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવાની કામગીરી - રેકર્ડની કામગીરી પર દેખરેખ રાખવી, રેકર્ડ એ, બી, સી, ડી, વાઈજ રેકર્ડ ગોઠવવો - જમીન મિલક્ત વિભાગ ધ્વારા જોન વિસ્તારમાં ડે. ઈજનેરશ્રીની સુચના મુજબ મહાનગરપાલિકાનાં સામાજિક સુવિધા આપવાનાં હેતુ માટે નડતરરૂપ જુંપડપટ્ટીનાં સર્વેની કામગીરી - ફર્સ્ટ ગ્રેડ કલાર્કની ગેરહાજરીમાં તેમને સોંપવામાં આવેલ કામગીરી. |
| ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક | <ul style="list-style-type: none"> - જાહેર જનતા તરફથી આવતી અરજીઓ સ્વીકારી તેની પહોંચ આપવાની કામગીરી એટલે કે ઈનવર્ડ, આઉટવર્ડ એમ બંને પ્રકારની કામગીરી, જે તે ખાતામાંથી આવતા પત્રનો નિકાલ વિગેરે કામગીરી, - ટેન્ડર કલાર્કની કામગીરી, - એસ્ટા. વિભાગની કામગીરી, - ફિલ્ડબુક કલાર્કની તેમજ વોર્ડ ઇન્સ્પેક્ટરની કામગીરી, - જન્મ-મરણ— લગ્ન નોંધણીની કામગીરી, રેકર્ડની કામગીરી સીવીક સેન્ટર કેશ કલેક્શન, ટેનામેન્ટનાં સ્થળ પર હપ્તા વસુલાત, - દબાણ ખાતા ધ્વારા આવેલ લારીઓ વિગેરે સામગ્રીનો દબાણ ચાર્જ વસુલ લેવો. - જમીન મિલક્ત ખાતાને લગતી જેવી કે ટેનામેન્ટનાં સ્થળ પર હપ્તા વસુલાત, દબાણ ખાતા ધ્વારા લાવેલ લારીઓ વગેરે સામગ્રીઓનો દબાણ ચાર્જ વસુલવાનો, સમગ્ર જોન વિસ્તારમાં આવેલ જુંપડપટ્ટીઓમાં સ્થળ પર ભાડા વસુલાત, શોપીંગ સેન્ટરમાં ભાડા વસુલાત, મંડપ ફી, ઈલેક્ટ્રોિક સબ સ્ટેશન જમીન ભાડા, દુધ સહકારી મંડળીના ડેપોનાં જમીન ભાડા, ખાનગી સર્વીસ પ્રોવાઈડર કંપનીઓની લાઈન/કેબલના ભાડા, સુ.ડી. ટેલીફોનને ફાળવેલ જગ્યાનાં ભાડા, કોસાડ, અમરોલી, છાપરાભાડા, ઉત્ત્રાણ વિસ્તારમાં આવેલ કેબીન/મકાન સ્થળ પર ભાડા વસુલાત |

નોર્થજોનમાં આવેલ સ્કુલ ભાડા, પે એન્ડ યુઝ ટોયલેટ ભાડા, હોકીગ, અપંગ તથા વિધવાઓને ફણવેલ જગ્યાના ભાડા વગેરે વસુલાતની કામગીરી, આવેલ અરજીઓ અંગે સ્થળ તપાસ અને નિકાલ તેમજ ઉપરોક્ત સમગ્ર કામગીરીઓને લગતી આનુસંધિક પેપર વર્ક કામગીરી વગેરે.

નાગરીક સુવિધા કેન્દ્ર

ઈ.ચા.સીવીક સેન્ટર

કામગીરી તેમના નેતૃત્વ હેઠળ કરવામાં આવે છે. તેમજ નાગરિક સુવિધા કેન્દ્ર પર આપવામાં આવેલ સુવિધાઓની વિગત નીચે મુજબ છે. જન્મ-મરણ પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા નોંધણી પ્રમાણપત્ર કલેક્શન : મિલ્કન્ટવેરો, શિક્ષણ ઉપકર, વિવિધ ચાર્જિસ, ડીપોઝિટ, પરયુરણ આવક, પેનલ્ટી વ્યાજ વિગેરેમિલ્કટ વેરાની સ્વાકારણી, વિવિધ ફરિયાદોની નોંધણી,

ઈ-મેઇલ ધ્વારા આવતી ફરિયાદો મહાનગરપાલિકાના હોલ, ઓપન પ્લોટનું બુકીગ મ્યુનિસિપલ ટેનામેન્ટ, ઈ.ડબલ્યુ.એસ.મકાનના હપ્તા તથા શોપીગ કોમ્પ્લેક્શનનું ભાડુ, ટી.પી.પાર્ટ પ્લાનની કોપી, તમામ પ્રકારની અરજીઓનું સ્વીકાર કેન્દ્ર તમામ પ્રકારના ફોર્મ તથા મહાનગરપાલિકાની પ્રકાશિત પુસ્તિકાઓનું વેચાણ વેબસાઈટ ધ્વારા પ્રાપ્ત માહિતીઓની ઓનલાઈન સુવિધા www.suratmunicipal.gov.in ઉપરથી નીચેની સુવિધા મળી શકશે. : વિવિધ ફોર્મનું ડાઉન લોડિંગ કર્મલેન્ડન નોંધણીટેન્ડર નોટિસની માહિતી, વિવિધ કમિટીઓના એજન્ડા તથા મહાનગરપાલિકાની અન્ય જાહેરાતો મહાનગરપાલિકાની રોજગારલક્ષી માહિતી જાહેર માહિતી અધિકારની અરજીઓ સ્વીકારી તેમજ તે અંગેની ફી વસુલ કરવાની કામગીરી નાગરિકો પોતે મહાનગરપાલિકા અંગેની માહિતી ઇન્ફોર્મેશન કીઓસ્ક મશીન ધ્વારા સરળતાથી મેળવી શકશે

ઓડિટોરીયમ(સરદાર પટેલ સ્મૃતિ ભવન):-

મેનેજર

ઓડિટોરીયમ ઓનલાઈન/ઓફલાઈન બુકિંગ, રીફંડ અંગેની મંજુરી તથા સમગ્ર ઓડિટોરીયમના સંચાલનને લગતી તમામ કામગીરી. વરાણ્ણા જોન હસ્તકના તમામ કોમ્પ્યુનીટી હોલ, પાર્ટી પ્લોટની રીફંડ અંગેના બીલની BCNT ઈન્ચાર્જ તરીકેની કામગીરી તથા સગવડ અને રીપેરીંગ કરવાની વહીવટી કામગીરી આયોજકોને નિયમો ચાર્જિસ, જરૂરી પરવાનગી, હોલમાં ઉપલબ્ધ સવલતો વિગેરેની વિસ્તૃત સમજણ આપવી તથા હોલની વિઝીટ કરી કાર્યક્રમના સેશનદીઠ તમામ પ્રક્રકોની ચકાસણી કરી એન્ટ્રી આપવાથી લઈ સમયસર કાર્યક્રમ પૂર્ણ કરવા સુધીની કામગીરી ઓડિટોરીયમ હોલ તથા સમગ્ર પ્રિમાઈસીસમાં સ્વચ્છતા જણવાઈ રહે તે અંગે દેખરેખની કામગીરી.

સામાન્ય બાબત

સુરત મહાનગરપાલિકાનો સમગ્ર વહીવટ અને કામગીરી અલગ અલગ ખાતાઓમાં વહેંચાયેલ છે જેથી ખાતાવાર જે તે કર્મચારીઓને જે તે ખાતામાં ચાલતા કામ અનુસાર કામગીરી કરવાની રહે છે. પરંતુ સામાન્ય રીતે કર્મચારીઓ તેઓની કેડર અનુસાર કામગીરી સોંપવામાં આવે છે ત્રીજી શ્રેણીના કલાર્કને તેમની કેડરને અનુરૂપ કામગીરી તેમજ બીજી શ્રેણી કલાર્કને તેમની કેડરને અનુરૂપ કામગીરી સોંપવામાં આવે છે, જુદા જુદા ખાતામાં જુદા જુદા પ્રકારની કામગીરી જે તે કર્મચારીને સોંપવામાં આવે તે જે તે કર્મચારીએ વિના સંકોચે સ્વીકારી લેવી જોઈએ તે તેમની પ્રાથમિક ફરજ છે અને જે બાબતમાં કર્મચારીને સમજ ન પડે અગાર તો અજાણ હોય તો તેબાબતનું માગદર્શન કર્મચારીઓએ ઉપરી અધિકારી તરફથી મેળવી લેવું જોઈએ અને બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વિસંગતતા ઉભી ન થાય તથા સહજ અને સુગમ રીતે કામગીરી થાય તેવો કર્મચારીએ પ્રયત્ન કરવો જોઈએ, એવો અભિગમ રાખવો જોઈએ.

મુદ્રા નં.૦૩ :— દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ :

પૂર્વ(વરાળ)જોન(એ)માં અન્ય જોનની જેમ નીચે મુજબના અધિકારીઓને વિવિધ કામગીરી સુપ્રત કરવામાં આવી છે. જેથી નાગરિકો જે તે કામગીરી માટે જે તે અધિકારીનો સીધો સંપર્ક કરી શકશે.

| | | |
|-----------------------------------------------|-----------------------------|------------------------|
| | કમિશનર | |
| | જોનલ ચીફ | |
| કાર્યપાલક ઈજનેર | આસીસ્ટન્ટ કમિશનર | નાયબ આરોગ્ય અધિકારી |
| ડેઝનેર | —ગુમાસ્તાધારા ઈન્સ્પેક્ટર | આસી.જંતુનાશક અધિકારી |
| આસી.ઈજનેર/જુ.ઈજનેર | હેડકલાર્ક | આરોગ્ય નિરીક્ષક |
| સુપરવાઈઝર | કલાર્ક | મદદનીશ આરોગ્ય નિરીક્ષક |
| આસી.ટાઉન પ્લાનર | પટાવણા | પ્રાય.હેલ્થ વર્કર |
| ટેક.આસી. | —ડે.એકાઉન્ટન્ટ | બેલદાર |
| સેક્શન ઓફિસર(ટેક.) | સેક્શન ઓફિસર | મુખ્ય આરોગ્ય નિરીક્ષક |
| પ્રથમ શ્રેણી કલાર્ક | હેડ કેશીયર | આરોગ્ય નિરીક્ષક |
| બીજી શ્રેણી કલાર્ક | કેશીયર | મદદનીશ આરોગ્ય નિરીક્ષક |
| ત્રીજી શ્રેણી કલાર્ક | સીની.કલાર્ક | મુકાદમ |
| | જુની.કલાર્ક | |
| પ્રાઇવેન | પટાવણા | |
| બેલદાર | —આકારણી અને વસુલાત અધિકારી | |
| ટ્રેસર | સેક્શન ઓફિસર | |
| પ્રાઇવર | હેડકલાર્ક | |
| કલીનર | સર્વેયર | |
| પેઇન્ટર | વોર્ડ ઈન્સ્પેક્ટર | |
| કટિયા | ફિલ્ડ બુક કલાર્ક | |
| સુથાર | પટાવણા | |
| | —પરોનેલ ઓફિસર | |
| | સેક્શન ઓફિસર | |
| મેઈન્ટેનાન્સ આસી.(ઈલે.) | હેડકલાર્ક | |
| વાયરમેન | ચેકીંગ કલાર્ક | |
| એ.સી.પ્લાન્ટ(મિકે.)એન્ડ સાઉન્ડ લાઈટ ઓપરેટર | એસ્ટા.કલાર્ક | |
| | પ્રોસી.કલાર્ક | |
| | પટાવણા | |
| | —મેનેજર સીટી સીવીક | |
| | હેડ કેશીયર | |
| | સીની.કલાર્ક ભરણા | |
| | પટાવણા | |
| | —આસી. લો ઓફિસર અને એપેલેટ | |
| | ઓફિસ સર્વેયર | |
| | જુની.કલાર્ક | |
| | પટાવણા | |
| | —જમીન મિલકત ખાતું | |
| | સીની.કલાર્ક, જુની.કલાર્ક | |
| | પટાવણા | |
| | પ્રાઇવર | |
| | —સરદાર પટેલ સ્મૃતિ ભવન | |
| | મેનેજર | |
| | સીની.કલાર્ક, જુની.કલાર્ક | |
| | પટાવણા | બેલદાર/સફાઈ કામદાર |
| | —સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમ | |
| | સીની.કલાર્ક, જુની.કલાર્ક | |

ઉપરોક્ત અધિકારીઓની કામગીરી અને જવાબદારી બાબતે મુદ્રા નં.૨માં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલું જ નહિ પણ આ બાબતે જરૂરી વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ

www.suratmunicipal.gov.in ઉપર ઉપલબ્ધ છે જે અવલોકનમાં લેવા વિનંતી.

મુદ્રા નં.૪:

કલમ-૪(૧)(ખ)(૪):— ફરજો અદા કરવા માટે નિયત કરવામાં આવેલ ધારા ધોરણ / પદ્ધતિ અંગેની વિગત :—

:- કોઈપણ પ્રકારની ફરજો અદા કરવા માટે તેમજ માલ સામાનની ખરીદી માટે નીચે મુજબની પદ્ધતિ અપનાવવામાં આવે છે.

કોઈપણ પ્રકારની કામગીરી સપ્રત કરવા માટે

- ૧) ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવે છે.
- ૨) કવોટેશન મંગાવવામાં આવે છે.
- ૩) માન્ય ઈજારદારોને નિયત થયેલ દરે કામગીરી સોંપવામાં આવે છે.

ટેન્ડરની પદ્ધતિ

- ૧) કોરા નિયત કરેલ ફોર્મમાં ટેન્ડર ઈસ્યુ કરવામાં આવે છે.
- ૨) ઓન લાઈન ઉપર ઈ-ટેન્ડરીંગ કરવામાં આવે છે જેમા ટેન્ડરની તારીખ અને તેની અંતિમ તારીખ પણ દર્શાવવામાં આવે છે. (રૂ.૦૨ લાખ થી વધુ કામગીરી માટે)
- ૩) પ્રિ - બીડ કોન્ફરન્સ (રૂ.૫૦ લાખ થી વધુ કામગીરી માટે)
- ૪) અંતિમ તારીખ સુધીમાં આવેલા ટેન્ડરોની રસીદ આપવામાં આવે છે.આર.પી.એડી તથા સ્પીડ પોસ્ટથી હિસાબી વિભાગમાં સ્વીકારવામાં આવે છે.
- ૫) ટેકનીકલ બીડ ખોલવામાં આવે છે.
- ૬) ટેકનીકલ બીડનું મુલ્યાંકન કરવામાં આવે છે.
- ૭) માન્ય ઈજારદાર જણાતાં તેનું પ્રાઇસબીડ ખોલવામાં આવે છે.
- ૮) સમગ્ર ટેન્ડરીંગ પ્રક્રિયાનું મુલ્યાંકન કરવામાં આવે છે.
- ૯) ટેન્ડર સ્કુટીની સમક્ષ ચકાસણી અર્થે રીપોર્ટ રજૂ કરવામાં આવે છે. (રૂ.૫ લાખથી વધુ ૨ક્રમ માટે)
- ૧૦) સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવે છે.
- ૧૧) સ્ટેન્ડીંગ કમિટી ધ્વારા ઈજારદાર નક્કી કરવામાં આવે છે.
- ૧૨) નક્કી કરેલ ઈજારદારને વર્ક ઓર્ડર આપવામાં આવે છે.

ફરજો અદા કરવા માટે વધુ વિગતોની જાણકારી માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ

www.suratmunicipal.gov.in ઉપલબ્ધ છે જે અવલોકનમાં લેવા વિનંતી.

મુદ્રા નં.૫:

કલમ-૪ (૧) (ખ) (૫) સંસ્થામાં નિભાવવામાં આવતાં દફતરીકરણની વિગતો

મહાનગરપાલિકાની સમગ્ર કામગીરી સને ૧૯૪૮ નાં મુંબઈ પ્રાંતીય મહાનગરપાલિકાઓનાં અધિનિયમમાં નિર્દિષ્ટ જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવે છે અને તે સિવાય સુરત મહાનગરપાલિકાને ગુજરાત રાજ્ય સેવાના નિયમો, શોપ એન્ડ એસ્ટાભલીશમેન્ટ એક્ટ, મીનીમમ વેજીસ એક્ટ, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ વિગેરે કાયદાઓ અનુસાર દફતરોની નિભાવણી કરવામાં આવે છે.

આ બાબતે વધુ વિગતોની જાણકારી માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in ઉપલબ્ધ છે જે અવલોકનમાં લેવા વિનંતી.

૪.૨) એ – કેટેગરી:-

- (૧) માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અને
- (૨) માહિતી અધિકાર નિયમ-૨૦૧૦
- (૩) આરટીઆઈ એક્ટની કલમ૧૮(૧) હેઠળ નાગરિકો તરફથી કરવામાં આવતી પ્રથમ અપીલો
- (૪) અપીલ રજીસ્ટર વર્ષ વાઈજ થયેલ અપીલ સંખ્યા-
- (૧) ૨૦૧૨-૧૩ :- ૫૦ (૨) ૨૦૧૩-૧૪ :- ૬૨ (૩) ૨૦૧૪-૧૫ :- ૧૬૦
- (૪) ૨૦૧૫-૧૬ :- ૧૦૩ (૫) ૨૦૧૬-૧૭ :- ૧૧૪ (૬) ૨૦૧૭-૧૮ :- ૧૩૮
- (૭) ૨૦૧૮-૧૯ :- ૨૦૩ (૮) ૨૦૧૯-૨૦ :- ૧૮૫ (૯) ૨૦૨૦-૨૧ :- ૧૮૫
- (૧૦) ૨૦૨૧-૨૨ :- ૬૨ (૧૧) ૨૦૨૨-૨૩ :- ૫૫

મુદ્દા નં.૬:

કલમ-૪(૧)(ખ) (૬): નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગનું પત્રક:-

૪.૧ સરકારી દસ્તાવેજો વિશેની માહિતી આપવા નીચેના નમૂનાનો ઉપયોગ કરશો. જ્યાં આ દસ્તાવેજો ઉપલબ્ધ છે તેવી જગ્યાઓ જેવી કે સચિવાલય કક્ષા, નિયામકની કચેરી કક્ષા, અન્યનો પણ ઉલ્લેખ કરો. ('અન્યો' લખવાની જગ્યાએ કક્ષાનો ઉલ્લેખ કરો.)

| ક્રમ નં. | દસ્તાવેજનીકક્ષા | દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ | દસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતિ | નીચેની વ્યક્તિ પાસે છે / તેની નિયંત્રણમાં છે. |
|----------|-----------------|-------------------------------------------|------------------------------------------------------|-----------------------------------------------|
| ૧ | સરકારશ્રી | ગુજરાત સીવીલ સર્વિસેઝ રૂલ્સ ૨૦૦૨ | અરજી કરીને નિયત ફી ભરીને પહોંચ રજૂ કર્યેથી મળી શકશે. | એસ્ટાબ્લીશમેન્ટ શાખા |

| | |
|---|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| ૨ | <p>: બી.પી.એમ.સી એક્ટ ૧૯૪૮</p> <p>: ગુજરાત સીવીલ સર્વિસ રૂલ્સ (જીસીએસઆર)</p> <p>: જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ</p> <p>: ટાઉન પ્લાનીંગ એક્ટ.</p> <p>: મ્યુનિસિપલ બાય લોઝ</p> <p>: માંસ, માછલી અને નોન-વેજીટેબલ ખાદ્ય પદાર્થોના ખાનગી જગ્યાઓ ઉપર વેચાણ પર આપવામાં આવતા લાઈસન્સ અંગેના નિયમો.</p> <p>: પ્રિવેન્શન ઓર્ડ કુઅલ્ટી ટુ એનીમલ (સ્લોટર હાઉસ) રૂલ્સ, ૨૦૦૧</p> <p>: બી.સી.એસ.આર. નાણાંકીય તથા અન્ય નિયમો</p> <p>ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો સને ૨૦૦૨ નો પરિયય</p> <p>ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થુ) નિયમો, ૨૦૦૨ નો પરિયય</p> <p>ખાતાકીય તપાસના નિયમો</p> <p>નોકરીની સામાન્ય શરતોના નિયમો, ૨૦૦૨</p> <p>ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમો સને ૨૦૦૨ના પરિયય</p> <p>ખાતાકીય તપાસ, , ૮/૧૮/૨૭, નાણાંકીય, વર્તણુંક, શિસ્ત, પગાર, રજા વિગેરે નિયમોનો પરિયય ફક્ત દરાવો, હુકમો અને પરિપત્રો જનરલ બોર્ડ મ્યુ. રૂલ્સ પાર્ટ-૧ અને પાટ-૨</p> <p>કમિશનરશ્રી તરફથી વખતોવખત બહાર પાડવામાં આવતા પરિપત્રો, નોંધ વિ</p> <p>ગુજરાત સરકાર તરફથી વખતોવખત બહાર પાડવામાં આવતા હુકમો, દરાવો (જી.આર.) વિગેરે</p> |
|---|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|

ફરજો અછા કરવા માટે વધુ વિગતોની જાણકારી માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ

www.suratmunicipal.in ઉપલબ્ધ છે જે અવલોકનમાં લેવા વિનંતી.

મુદ્દા નં.૭ :

કલમ:-૪(૧)(ખ)(૭) : નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના ધ્વારા રજૂઆત માટેની વિધમાન કોઈ વ્યવસ્થાની વિગતો :–

સુરત મહાનગરપાલિકાનો સમગ્ર વહીવટ ઉપર જણાવ્યા મુજબ મુખ્યત્વે સને ૧૯૪૮ ના મુંબઈ પ્રાંતિય મહાનગરપાલિકાઓના અધિનિયમની જોગવાઈઓ અનુસાર કરવામાં આવે છે. સદરહુ અધિનિયમમાં જણાવ્યા અનુસાર મુખ્યત્વે ૧૨ ચુંટાયેલા સભ્યોની બનેલી સ્થાયી સમિતિ ધ્વારા નીતિ વિષયક નિર્ણય લેવામાં આવે છે અને તે મુજબ તેનું કમિશનરશ્રી અને તેના તાબા હેઠળનાં અધિકારીઓ ધ્વારા તેનું અમલીકરણ કરવામાં આવે છે.

આ બાબતે વધુ વિગતોની જાણકારી માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ WWW.SURATMUNICIPAL.GOV.IN ઉપલબ્ધ છે જે અવલોકનમાં લેવા વિનંતી.

મદ્દા નં.૮ :- સલાહના હેતુઓ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ વિ. :- પૂર્વ(વરાધા)જોન ના ઝોન વિસ્તારની વોર્ડ કમિટીની માહિતી.
(ઈલેક્શન એન્ડ સેન્સસ વિભાગ દ્વારા પ્રકાશીત કરવામાં આવે છે)

કલમ-૪(૧)(ખ)(૮)સંસ્થાની ફરજો અદા કરવા માટે સંસ્થાની સામાન્ય સભા તેમજ વિવિધ સમિતિઓની કરવામાં આવેલ રચનાની બેઠકો તેમજ તેમાં લેવાયેલ નિર્ણયોની મીનીટ્સ અંગેની વિગતો :— સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પ્રતિ માસે ઓછામાં ઓછી એકવાર મળતી હોય છે. જેમાં જાહેર જનતા માટે પ્રેક્ષક ગેલેરીની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં બેસી તેઓ પણ આ કામગીરી નીછાળી શકે છે. તે સિવાય ૧૨ ચુંટાયેલા સભ્યોની સ્થાયી સમિતી બેઠક પણ સપ્તાહમાં એક દિવસ નિયત કરેલા સમયે ચોજવામાં આવે છે. જેમાં સામાન્ય નાગરિકોને પ્રવેશ આપવામાં આવતો નથી. તે સિવાયની અન્ય ખાસ સમિતિઓ અને તદર્થ સમિતિઓની બેઠક સમયાંતરે મળતી હોય છે. આ સમિતિઓનાં એજન્ડા અને હરાવોની વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ www.suratmunicipal.gov.in ઉપર ઉપલબ્ધ છે જે અવલોકનમાં લેવા વિનંતી.

| ક્રમ | ઈલેક્શન વોર્ડ નંબર | મ્યુ. સભ્યશ્રીનું નામ | હોદ્દો |
|------|------------------------------------------|---------------------------------------------|----------------|
| ૧ | વોર્ડ નં. ૪ (કાપોદ્રા) | શ્રીમતી કુંદનબેન હરેશભાઈ કોઠિયા | મ્યુ. સભ્યશ્રી |
| ૨ | | શ્રીમતી સેજલબેન જિજનેશભાઈ માલવિયા | મ્યુ. સભ્યશ્રી |
| ૩ | | શ્રી ધનશ્યામ ગોવિંદભાઈ મકવાણા | મ્યુ. સભ્યશ્રી |
| ૪ | | શ્રી ધમેન્દ્ર છગનભાઈ વાવલીયા | મ્યુ. સભ્યશ્રી |
| ૧ | વોર્ડ નં. ૫ (કુલપાડા - અંશેવનીકુમાર) | શ્રીમતી નિરાલી સંજયકુમાર પટેલ | મ્યુ. સભ્યશ્રી |
| ૨ | | શ્રીમતી મનિષાબેન જગદીશભાઈ કુકડિયા | મ્યુ. સભ્યશ્રી |
| ૩ | | શ્રી કિરણકુમાર ભગવાનભાઈ ખોંખાડી (રમતો જોગી) | મ્યુ. સભ્યશ્રી |
| ૪ | | શ્રી અશોકભાઈ કરશનભાઈ ધામી (કે.કે.) | મ્યુ. સભ્યશ્રી |
| ૧ | વોર્ડ નં. ૧૪ (ઉમરવાડા - માતાવાડી) | શ્રીમતી રાજેશ્વરીબેન સતીષભાઈ મૈસુરિયા | મ્યુ. સભ્યશ્રી |
| ૨ | | શ્રીમતી મધુબેન મંજુભાઈ ઘેણી | મ્યુ. સભ્યશ્રી |
| ૩ | | શ્રી દિનેશભાઈ વાધજીભાઈ જોઘાણી | મ્યુ. સભ્યશ્રી |
| ૪ | | શ્રી નરેશભાઈ હરજીભાઈ ધામેલીયા | મ્યુ. સભ્યશ્રી |
| ૧ | વોર્ડ નં. ૧૫ (કરંજ - મગોબ) | શ્રીમતી મનિષા આહિર | મ્યુ. સભ્યશ્રી |
| ૨ | | શ્રીમતી રૂપાબેન ભાર્ગવભાઈ પંડ્યા | મ્યુ. સભ્યશ્રી |
| ૩ | | શ્રી રાજુભાઈ જોળીયા | મ્યુ. સભ્યશ્રી |
| ૪ | | શ્રી ધર્મશ ભાલાણા | મ્યુ. સભ્યશ્રી |
| ૧ | વોર્ડ નં. ૧૬ પુણા (પશ્ચિમ) | શ્રીમતી પાયલ કિશોરભાઈ સાકરીયા | મ્યુ. સભ્યશ્રી |
| ૨ | | શ્રીમતી શોભનાબેન કિરીટભાઈ કેવીયા | મ્યુ. સભ્યશ્રી |
| ૩ | | શ્રી જીતેન્દ્રભાઈ પાચાભાઈ કાછીયા | મ્યુ. સભ્યશ્રી |
| ૪ | | શ્રી વિપુલભાઈ વીરભાઈ મોવલીયા | મ્યુ. સભ્યશ્રી |
| ૧ | વોર્ડ નં. ૧૭ પુણા (પૂર્વ) | શ્રીમતી રચના અંકુરભાઈ હીરપરા | મ્યુ. સભ્યશ્રી |
| ૨ | | શ્રીમતી સ્વાતિબેન પ્રજોશભાઈ કયાડા | મ્યુ. સભ્યશ્રી |
| ૩ | | શ્રી વિપુલભાઈ વશરામભાઈ સુહાગીયા | મ્યુ. સભ્યશ્રી |
| ૪ | | શ્રી ધર્મશભાઈ જ્યંતિભાઈ ભડેરી | મ્યુ. સભ્યશ્રી |
| ૧ | વોર્ડ નં. ૧૮ લિંબાયત-પરવર્ત-કુંભારીયા | શ્રીમતી અમિતાબેન ભરતભાઈ પટેલ | મ્યુ. સભ્યશ્રી |
| ૨ | | શ્રીમતી દર્શિનીબેન પ્રવિષ્ટભાઈ કોઠિયા | મ્યુ. સભ્યશ્રી |
| ૩ | | શ્રી ગોમર એચ. દેસાઈ | મ્યુ. સભ્યશ્રી |
| ૪ | | શ્રી દિનેશ પુરોહિત (રાજપુરોહિત) | મ્યુ. સભ્યશ્રી |

મદ્દા નં.૯ :

કલમ-૪(૧)(ખ)(૯) : અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તકા :-

બીસીએન્ટી વાઈજ અધિકારી અને કર્મચારીઓની માહિતી www.suratmunicipal.gov.in

૫૨ સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે. તથા અત્રેના ખાતાના કર્મચારીઓના મહેકમ દર્શાવતી તથા ૫૨૨ રજીસ્ટરની નકલ ખાતામાં ઉપલબ્ધ છે.

મુદ્રા નં. ૧૦ :

કલમ-૪(૧)(ખ)(૧૦): દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક મહેનતાણા:-

બીસીએનટી વાઈજ અધિકારી અને કર્મચારીઓની માહિતી www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે. તથા અત્રેના ખાતાના કર્મચારીઓના મહેકમ દફતર તથા પગાર રજીસ્ટરની નકલ ખાતામાં ઉપલબ્ધ છે.

મુદ્રા નં. ૧૧ :

કલમ-૪(૧)(ખ)(૧૧) : તમામ યોજનાઓ, સુચિત ખર્ચ, ચૂકવેલ નાણા પરના અહેવાલોની

વિગતો દર્શાવતું અંદાજપત્ર

બીસીએનટી વાઈજ માહિતી www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે.

મુદ્રા નં. ૧૨ : મ્યુ.કમિશનરશ્રી ધ્વારા મંજુર કરેલ વ્યક્તિગત લાભાર્થીઓની યાદી

**આરોગ્ય વિભાગ, ઈસ્ટાનોન-એ
અનુદાન હેઠળ સોસાયટીની માહિતી**

| અ.નં | વોર્ડનું નામ | સોસાયટીનું નામ | અ.નં | વોર્ડનું નામ | સોસાયટીનું નામ |
|------|--------------|---------------------------------------|------|--------------|-----------------------------------|
| 1 | નવાગામ-એ | પુરુષાર્થ કો.ઓ.હા.સોસાયટી લિ. | 22 | નવાગામ-બી | પંચદેવ કો.ઓ.હા.સોસા.લિ. |
| 2 | નવાગામ-એ | શ્રી અંકુર કો.ઓ.હા.સોસાયટી વિભાગ-૪ | 23 | નવાગામ-બી | અશ્વીન કો.ઓ.હા.સોસા.લિ.વિભાગ-૧ |
| 3 | નવાગામ-એ | દેવજીનગર કો.ઓ.હા.સોસાયટી લિ. વિ-૧ | 24 | નવાગામ-બી | શ્રી કસ્તુરભાનગરકો.ઓ.હા.સોસા.લિ. |
| 4 | નવાગામ-એ | ડાયમંડનગર સોસાયટી | 25 | નવાગામ-બી | સોમેશ્વર કો.ઓ.હા.સોસાયટી |
| 5 | નવાગામ-એ | ધામેલીયા નગર કો.ઓ.હા.સોસા. | 26 | નવાગામ-બી | સોહમનગર વિભાગ-૨ |
| 6 | નવાગામ-એ | રૂભી ટ્રેડ સેન્ટર એસોસીએશન | 27 | નવાગામ-બી | તપસીલ કો.ઓ.હા.સોસાયટી |
| 7 | નવાગામ-એ | શ્રી અંકુર કો.ઓ.હા. સોસા. વિભાગ-૧ | 28 | નવાગામ-બી | ઉર્મી કો.ઓ.હા.સોસા.લિ. |
| 8 | નવાગામ-એ | પ્રભુદર્શન, ગ્રીનપાર્ક સોસાયટી | 29 | નવાગામ-બી | અંબીકાવિજ્ય હા.સોસાયટી |
| 9 | નવાગામ-એ | સુર્યપુર ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસા. લિ. | 30 | નવાગામ-બી | વિહળનગર .સોસાયટી |
| 10 | નવાગામ-એ | દી અજંટા ડાયમંડ ઈન્ડ.કો.ઓ.હા.સો.લિ. | 31 | નવાગામ-બી | કૃષ્ણનગર કો.ઓ.હા.સોસાયટી |
| 11 | નવાગામ-એ | નંદપાર્ક .કો.ઓ.હા.સોસા. લિ. | 32 | નવાગામ-બી | શ્રી લક્ષ્મીભાનગર કો.ઓ.હા.સોસાયટી |
| 12 | નવાગામ-એ | ઉર્મીયાનગર સોસાયટી | 33 | નવાગામ-બી | રત્નનગર કો.ઓ.હા.સોસાયટી |
| 13 | નવાગામ-એ | શાંતીવન કો.ઓ.હા.સોસા. લિ. | 34 | નવાગામ-બી | ખોડીયારનગર કો.ઓ.હા.સોસાયટી |
| 14 | નવાગામ-એ | દેવજીનગર કો.ઓ.હા.સોસા. વિભાગ-૨ | 35 | નવાગામ-બી | શ્રી હરીરામભાપાનગર સોસાયટી |
| 15 | નવાગામ-એ | શ્યામનગર કો.ઓ.હા.સોસાયટી | 36 | નવાગામ-બી | ગણેશ કોલોની |
| 16 | નવાગામ-એ | ટિવાળીભાગ ઈન્ડ.કો.ઓ. સર્વિસ સોસાયટી | 37 | નવાગામ-બી | વિષ્ણુનગર કો.ઓ.હા.સોસા.લિ.વિ. ૧ |
| 17 | નવાગામ-બી | અશ્વીન કો.ઓ.હા.સોસા.લિ. વિ. ૩ | 38 | નવાગામ-બી | સૌરાષ્ટ્ર કો.ઓ.હા.સોસા.લિ. વિ. ૧ |
| 18 | નવાગામ-બી | શ્રી ચિત્રકુટ કો.ઓ.હા.સોસા.લિ. | 39 | નવાગામ-બી | રાધાકૃષ્ણ કો.ઓ.હા.સોસા.લિ. |
| 19 | નવાગામ-બી | શ્રી નિજાનંદ કો.ઓ.હા.સોસાયટી | 40 | નવાગામ-બી | શ્રી રામનગર કો.ઓ.હા.સોસાયટી |
| 20 | નવાગામ-બી | રામદેવપીરનગર સોસાયટી | 41 | નવાગામ-બી | અશ્વીન કો.ઓ.હા.સોસા.લિ.વિ.-૨ |
| 21 | નવાગામ-બી | જય આશાપુરી કો.ઓ.હા.સોસા.લિ. | 42 | નવાગામ-બી | શક્તિવિજ્ય કો.ઓ.હા.સોસાયટી |

| | | | | | |
|----|------------|-------------------------------------|-----|----------|--------------------------------------|
| 43 | નવગામ-બી | શ્વેતરાજહંસ કો.ઓ.હા.સોસા.લિ. | 77 | કરંજ-એ | વર્ષા કો.ઓ.હા.સોસા.પાર્ટ-૧ |
| 44 | નવગામ-બી | શીરડીધામ હા.સોસાયટી | 78 | કરંજ-એ | રંગઅવધુત કો.ઓ.હા.સોસા.લિ. |
| 45 | નવગામ-બી | વિદૃલનગર કો.ઓ.હા.સોસા.લિ. | 79 | કરંજ-એ | ભવાનીનગર કો.ઓ.હા.સોસા.લિ. |
| 46 | નવગામ-બી | અનુરાધા કો.ઓ.હા.સોસાયટી | 80 | કરંજ-એ | ભગુનગર કો.ઓ.હા.સોસા.લિ. |
| 47 | નવગામ-બી | તેજન્દ્ર પાર્ક કો.ઓ.હા.સોસા.લિ. | 81 | કરંજ-બી | જવાહરનગર કો.ઓ.હા. સર્વિસ સોસા. |
| 48 | નવગામ-બી | હંસ કો.ઓ.હા.સોસાયટી | 82 | કરંજ-બી | ગોપાલનગર કો.ઓ.હા.સોસા.લિ. |
| 49 | નવગામ-બી | શ્રી મહેશ્વર કો.ઓ.હા.સોસા.લિ. | 83 | કરંજ-બી | તિરુપ્તીનગર સોસાયટી |
| 50 | નવગામ-બી | ગુરુનગર પ્રા.સ.સ.ધર મંડળી લી. | 84 | કરંજ-બી | તિરુપ્તી કો.ઓ.હા.સોસા. વિ.૨ |
| 51 | નવગામ-બી | નર્મદનગર કો.ઓ.હા.સોસાયટી | 85 | કરંજ-બી | રણજીતનગર કો.ઓ.હા.સોસા.લિ. |
| 52 | નવગામ-બી | વલ્લભનગર કો.ઓ.હા.સોસા.લિ. | 86 | કરંજ-બી | જય સંતોષી નગર કો.ઓ.હા.સર્વિસ સોસાયટી |
| 53 | નવગામ-બી | શ્રી મહેશ્વર કો.ઓ.હા.સોસા.લિ. | 87 | કાપોડ્રા | કલાકુંજ સમ્ભ્ય મંડળ |
| 54 | નવગામ-બી | ગુરુનગર પ્રા.સ.સ.ધર મંડળી લી. | 88 | કાપોડ્રા | શ્રીજી નગર હા.સોસા. ૧ |
| 55 | નવગામ-બી | નર્મદનગર કો.ઓ.હા.સોસાયટી | 89 | કાપોડ્રા | દશરથનગર કો.ઓ.હા.સોસા. |
| 56 | નવગામ-બી | શ્રી હરીરામભાપાનગર સોસાયટી | 90 | કાપોડ્રા | ગલાણીનગર કો.ઓ.હા.સોસા. |
| 57 | નવગામ-બી | ગણેશ કોલોની | 91 | કાપોડ્રા | રચના કો.ઓ.હા.સોસા. |
| 58 | લંબેહનુમાન | શિવનગર કો.ઓ.હા.સોસા.લિ. | 92 | કાપોડ્રા | ગાયત્રીનગર સોસાયટી |
| 59 | લંબેહનુમાન | કૃષ્ણનગર હાઉસીંગ સોસાયટી | 93 | કાપોડ્રા | સિધ્ધીપાર્ક સોસા. |
| 60 | લંબેહનુમાન | કમલબાગ કો.ઓ.હા.સોસાયટી | 94 | કાપોડ્રા | દશરથનગર કો.ઓ.હા.સોસા. |
| 61 | લંબેહનુમાન | સપના કો.ઓ.હાઉસીંગ સો. લિ. | 95 | કાપોડ્રા | ગલાણીનગર કો.ઓ.હા.સોસા. |
| 62 | લંબેહનુમાન | શ્રી ગોકુળનગર સોસાયટી | 96 | કાપોડ્રા | રચના કો.ઓ.હા.સોસા. |
| 63 | લંબેહનુમાન | લક્ષ્મીનગર સોસાયટી | 97 | કાપોડ્રા | ગાયત્રીનગર સોસાયટી |
| 64 | લંબેહનુમાન | મનમોહન કો.ઓ.હા.સોસાયટી | 98 | કાપોડ્રા | સિધ્ધીપાર્ક સોસા. |
| 65 | લંબેહનુમાન | નંદેશ્વરી સોસાયટી | 99 | કાપોડ્રા | યમુનાકુંજ કો.ઓ.હા.સોસા. |
| 66 | લંબેહનુમાન | જોલી એન્કલેવ કો.ઓ.હા.સર્વિસ સોસાયટી | 100 | કાપોડ્રા | કમલપાર્ક કો.ઓ.સોસા.લિ.વિ.-૨ |
| 67 | લંબેહનુમાન | વિકમનગર કો.ઓ.હા.સોસા.લિ. | 101 | કાપોડ્રા | ગોકુળનગર કો.ઓ.સોસા.લિ. |
| 68 | ભાગ્યોદય | જલવંત ટાઉનશીપ | 102 | કાપોડ્રા | સાગર કો.ઓ.હા.સોસા. |
| 69 | ભાગ્યોદય | અવસર કો.ઓ.હા.સોસા.લિ. | 103 | કાપોડ્રા | શ્રી સ્વામીનારાયણ નગર પાર્ટ-૧ |
| 70 | ભાગ્યોદય | સુવિધા રો હાઉસ | 104 | કાપોડ્રા | સ્વામીનારાયણનગર વિ.૨ |
| 71 | ભાગ્યોદય | સરગમ પાર્ક સોસાયટી | 105 | કાપોડ્રા | નિલકમલપાર્ક કો.ઓ.હા.સોસાયટી |
| 72 | ભાગ્યોદય | રૂષિ બંગલોઝ એસો. ઓફ પર્સન | 106 | કાપોડ્રા | શ્રીજીનગર સોસા.વિ.૨ |
| 73 | ભાગ્યોદય | સરિતાવિઆર કો.ઓ.હા.સોસા.વિ. ૧ | 107 | કાપોડ્રા | શ્રી રામકૃપા કો.ઓ.હા.સોસાયટી |
| 74 | ભાગ્યોદય | કાસા અમોરિના | 108 | કાપોડ્રા | સાંઈનાથ ગૃહ હા.સોસાયટી |
| 75 | કરંજ-એ | અવંતી ફ્લેટ્સ કો.ઓ.હા.સોસા.લિ. | 109 | કાપોડ્રા | વૃદ્ધાવન કો.ઓ.હા.સોસાયટી |

| | | | | | |
|-----|-------------|-------------------------------------------|-----|-------------|----------------------------------------------|
| 76 | કરંજ—ઓ | ગાંધીવિહાર કો.ઓ.હા.સોસા.લિ. | 110 | કાપોદ્રા | રન્સાગર કો.ઓ.હા.સોસા.લિ. |
| 111 | કાપોદ્રા | મમતાપાર્ક કો.ઓ.હા.સોસા.લિ. (સુચિત)ડિ.વિ.૧ | 135 | અશ્વનીકુમાર | વિશાળનગર સોસાયટી વિ-૧ |
| 112 | કાપોદ્રા | મમતાપાર્ક કો.ઓ.હા.સર્વિસ સોસા.લિ.વિ.૨ | 136 | અશ્વનીકુમાર | વિશાળનગર સોસાયટી વિ-૨ |
| 113 | કાપોદ્રા | મમતાપાર્ક વિ-૩ | 137 | અશ્વનીકુમાર | ધરમનગર કો.ઓ.હા.સોસા.લિ. |
| 114 | કાપોદ્રા | શંકરનગર કો.ઓ.હા.સોસાયટી | 138 | અશ્વનીકુમાર | જયરામનગર કો.ઓ.હા.સર્વિસ સોસા.લિ. |
| 115 | કાપોદ્રા | શ્રી વરાણા રોડ જનતાનગર કો.ઓ.સોસાયટી | 139 | અશ્વનીકુમાર | પુષ્પક કો.ઓ.હા.સોસા.લિ. વિ.૨ |
| 116 | કાપોદ્રા | શ્રી જી કૃપા કો.ઓ.હા. સોસા.લિ. | 140 | અશ્વનીકુમાર | શીતલપાર્ક સોસાયટી |
| 117 | કાપોદ્રા | શ્રી વડવાળાનગર સોસાયટી | 141 | અશ્વનીકુમાર | સુર્ઘનગર કો.ઓ.હા.સોસા.લિ. |
| 118 | કાપોદ્રા | શ્રી કૃપા કો.ઓ.સોસા.લિ. | 142 | અશ્વનીકુમાર | સહજપાર્ક કો.ઓ.હા.સોસા.લિ. |
| 119 | કાપોદ્રા | કમલપાર્ક કો.ઓ.હા.સોસા.લિ.૨ | 143 | અશ્વનીકુમાર | હિમતનગર કો.ઓ.હા.સોસાયટી |
| 120 | કાપોદ્રા | હરીધામ કો.ઓ.હા.સર્વિસ સોસાયટી | 144 | અશ્વનીકુમાર | હરીઓમ કો.ઓ.હા.સોસાયટી |
| 121 | કાપોદ્રા | અમરદિપ કો.ઓ.હા. સોસા.લિ. | 145 | અશ્વનીકુમાર | શ્વેતા કો.ઓ.હા.સોસાયટી |
| 122 | કાપોદ્રા | કિઝા ઈન્ડ. એસ્ટેટ | 146 | અશ્વનીકુમાર | શિવાંજલી રો હાઈસ |
| 123 | કાપોદ્રા | રવિપાર્ક સોસા. | 147 | ઘનવર્ષા | વિકમનગર સોસા.લિ.૪ |
| 124 | અશ્વનીકુમાર | રામબાગ કો.ઓ.હા.સોસા.લિ. | 148 | ઘનવર્ષા | સંતોષી કૃપા હા.સોસાયટી |
| 125 | અશ્વનીકુમાર | સીતારામનગર કો.ઓ.સર્વિસ સોસાયટી | 149 | ઘનવર્ષા | સીટીજન હાઈટ્સ |
| 126 | અશ્વનીકુમાર | શ્રી લક્ષ્મીનારાયણ નગર કો.ઓ.હા.સોસા.લિ.-૧ | 150 | ઘનવર્ષા | સાનિધ્ય રેસી.મેર્ચિનટેનન્સ એરો. |
| 127 | અશ્વનીકુમાર | લક્ષ્મીનારાયણ નગર કો.ઓ.હા.સોસા.લિ.-૨ | 151 | ઘનવર્ષા | સીટી પ્લાઝ કો.ઓ.હા.સર્વિસ સોસા. લિ. |
| 128 | અશ્વનીકુમાર | કેલાશધામ કો.ઓ.હા.સોસા.લિ. | 152 | ઘનવર્ષા | રાધા સ્વામી સોસા. |
| 129 | અશ્વનીકુમાર | ભક્તિનગર સોસાયટી વિ-૨ | 153 | ઘનવર્ષા | માધવપાર્ક સોસા |
| 130 | અશ્વનીકુમાર | રતનજીપાર્ક સોસાયટી વિ-૧ | 154 | ઘનવર્ષા | શુભમ હાઈટ્સ પાર્ટ ૦૫ કો.ઓ.હા.સર્વિસ સોસા.લિ. |
| 131 | અશ્વનીકુમાર | રતનજીપાર્ક સોસાયટી વિ-૨ | 155 | ઘનવર્ષા | કેલાશધામ સોસા. |
| 132 | અશ્વનીકુમાર | સૌરાષ્ટ્ર કો.ઓ.હા.સો.સોસા.લિ.વિ.૨ | 156 | ઘનવર્ષા | વિકમનગર સોસા.લિ.૧ |
| 133 | અશ્વનીકુમાર | યોગેશ્વર પાર્ક હા.સોસાયટી | 157 | ઘનવર્ષા | સુંદર વન સોસા. |
| 134 | અશ્વનીકુમાર | સતાધાર કો.ઓ.હા.સોસા.લિ. | | | |

| | | | | | |
|-----|---------|----------------------------------|-----|---------|----------------------------------------|
| 158 | ઘનવર્ધા | શિવ શક્તિ કો.ઓ.હા.સોસા.લિ. | 192 | પુષા—એ | પુષાનગર કો.ઓ.હા.સોસા. |
| 159 | ઘનવર્ધા | બજરંગનગર સોસા. | 193 | પુષા—બી | શ્રી સમાટ ગૃપ હા. સ્કીમ. |
| 160 | ઘનવર્ધા | રેશ્મા રો હાઉસ કો.ઓ.સર્વિસ સોસા. | 194 | પુષા—બી | ભાવના પાર્ક રો—હાઉસ |
| 161 | ઘનવર્ધા | મુક્તિધામ હા.સોસા. | 195 | પુષા—બી | વિજયનગર વિ.૦૨ પ્લોટ ઓનર એસો. |
| 162 | ઘનવર્ધા | શુભ રેસી.કો.ઓ.હા.સર્વિસ સોસા.લિ. | 196 | પુષા—બી | શાંતીનગર સોસા. |
| 163 | ઘનવર્ધા | રણુજાધામ સોસા. | 197 | પુષા—બી | શિવ શક્તિ સોસા. વિ.૦૨ |
| 164 | ઘનવર્ધા | વિકમનગર કો.ઓ.હા.સોસા.લિ.—૨ | 198 | પુષા—બી | શિવ શક્તિ સોસા.૦૧ |
| 165 | ઘનવર્ધા | ઈશ્વરનગર હા. સોસા.વિ.૨ | 199 | પુષા—બી | રૂક્ષમણી સોસા. વિ.૦૧ |
| 166 | ઘનવર્ધા | ખંસ્કારધામ હા.સોસા. | 200 | પુષા—બી | સરિત સોસા. |
| 167 | ઘનવર્ધા | ઈશ્વરનગર સોસા.વિ.૧ | 201 | પુષા—બી | ખોરીયારનગર લો.કોરટ.હા.સોસા.લી. |
| 168 | ઘનવર્ધા | વિકમનગર કો.ઓ.હા.સોસા.પાર્ટ—૩ | 202 | પુષા—બી | ચામુંડાનગર સોસા. |
| 169 | ઘનવર્ધા | શિવધારા રો હાઉસ ચેમ્બર્સ એસો. | 203 | પુષા—બી | નકંણ પાર્ક સોસા. |
| 170 | પુષા—એ | સરગમ સોસા. | 204 | પુષા—બી | અશોકવાટીકા કો.ઓ.હા.સોસા. |
| 171 | પુષા—એ | પ્રભુદર્શન કોઓ.હા.સોસાયટી | 205 | પુષા—બી | પ્રમુખછાયા રો હાઉસ વિ.સી એન્ડ ડી |
| 172 | પુષા—એ | અંબિકા નિકેતન સોસાયટી | 206 | પુષા—બી | સુર્યવંદન સોસા. |
| 173 | પુષા—એ | કર્મશ્વર સોસાયટી | 207 | પુષા—બી | ક્રિઝા રો હાઉસ |
| 174 | પુષા—એ | લક્ષ્મીનગર સોસાયટી | 208 | પુષા—બી | આમૃકુંજ કો.ઓ.હા.સોસા. |
| 175 | પુષા—એ | રાવે શ્યામ કો.ઓ.હા.સોસા. (સુચિત) | 209 | પુષા—બી | પ્રમુખછાયા રો હાઉસ વિ. ૧/૨ |
| 176 | પુષા—એ | ક્રિઝા પાર્ક કો.ઓ.હા.સોસાયટી | 210 | પુષા—બી | પ્રમુખપાર્ક હા.સોસા. |
| 177 | પુષા—એ | જયભવાની સોસાયટી | 211 | પુષા—બી | વિજયનગર વિ. ૧ |
| 178 | પુષા—એ | દાનગીગેવ સોસા.૧ | 212 | પુષા—બી | વનમાળી પાર્ક રો હાઉસ સોસા. |
| 179 | પુષા—એ | અભયધામ કો.ઓ.હા.સોસા. | 213 | પુષા—બી | સન્માન કો.ઓ.હા.સોસા.. (સુચિત) |
| 180 | પુષા—એ | શાંતી નિકેતન સોસા. | 214 | પુષા—બી | ઘ પેરેડાઇઝ કો.ઓ.હા.સર્વિસ સોસા.લિ. |
| 181 | પુષા—એ | દિવ્યશક્તિ કો.ઓ.હા.સોસા.લિ.—બી | 215 | પુષા—બી | મીલિનીયો રેસી. |
| 182 | પુષા—એ | અંજનીનગર સોસા. | 216 | પુષા—બી | શ્રી કૃષ્ણકુંજ સોસા. |
| 183 | પુષા—એ | સત્યનારાયણ કો.ઓ.હા.સોસા. | 217 | પુષા—બી | કરુણાનીધી રેસી. |
| 184 | પુષા—એ | સિદ્ધી વિનાયક રો—હાઉસ | 218 | પુષા—બી | વંદન હાઈટ્સ કો.ઓ.હા.સર્વિસ સોસા.લિ. |
| 185 | પુષા—એ | ગીતાનગર સોસા. પાર્ટ—૨ | 219 | પુષા—બી | પ્રજ વિવાન્તા કો.ઓ.હા.સર્વિસ સોસા. લિ. |
| 186 | પુષા—એ | સાંઈ નગર કો.ઓ.હા.સોસા. | 220 | પુષા—બી | શિક્ષાપત્રી એવન્યુ |
| 187 | પુષા—એ | આર્શીવાદ કો.ઓ.સર્વિસ સોસા.લિ. | 221 | પુષા—બી | આઈકોન હાઈટ્સ ઓનર એસોસીએશન (AOP) |
| 188 | પુષા—એ | કિરણપાર્ક કો.ઓ.સો.વિ.બી | 222 | પુષા—બી | મારવેલ હોમ્સ |
| 189 | પુષા—એ | હસ્તીનાપુર કો.ઓ.હા.સોસા. | 223 | પુષા—બી | ગજાનન કો.ઓ.હમ.સોસા.૩ |
| 190 | પુષા—એ | સહયોગ કો.ઓ.હા.સોસા.વિ.૦૧ | 224 | પુષા—બી | શ્રી નાથજી નગર |
| 191 | પુષા—એ | રૂક્ષમણી સોસા. વિ.૦૨ | 225 | પુષા—બી | કલ્યાણ નગર |

નાયબ આરોગ્ય અધિકારી
ઈસ્ટજોન—એ(વરાધા)

મૃદ્ગ નં. ૧૩:

કલમ-૪(૧)(ખ)(૧૩) : છુટછાટો, પરવાનગીઓ, અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો :-

જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

મૃદ્ગ નં. ૧૪:

કલમ-૪(૧)(ખ)(૧૪) : ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતીને લગતી વિગતો :-

અતેનાં ખાતાની અલાયદી માહિતી નથી.

મૃદ્ગ નં. ૧૫

કલમ-૪(૧)(ખ)(૧૫) : જાહેર ઉપયોગ માટે પૂર્વ(વરાણી)ઝોન(એ) ખાતે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલયો વિ.જાહેર વાંચનાલયો/રીડીગર્ડમોની માહિતી.

- ૧) જુની વરાણી ઝોન ઓફિસના ભૌંયતળીયે, મીનીબજાર, સુરત.
- ૨) ઈશ્વરકૃપા રોડ, કમલપાર્ક સોસા.ની પાસે, હેલ્થ સેન્ટરના માળ ઉપર, એલ.એચ.રોડ, સુરત.
- ૩) અક્ષરરદીપ શોપીંગ સેન્ટરના માળ ઉપર, હેલ્થ સેન્ટરની બાજુમાં, માતૃશક્તિ રોડ, સુરત.
- ૪) કરંજ વોર્ડ ઓફિસની ઉપર, સુઅેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં, ટોરેન્ટ પાવરની સામે, એલ.એચ.રોડ, સુરત.
- ૫) ફલડ ગેટ, ત્રણ પાંદડાના વડ પાસે, વોર્ડ ઓફિસની નીચે, મૈની ઓવારા, અશ્વનીકુમાર રોડ, સુરત.
- ૬) તિરૂપતિ સોસા., માર્ગતિયોક પાસે, એલ.એચ.રોડ, સુરત.
- ૭) વોર્ડ ઓફિસની બાજુમાં, પુણાગામ, સુરત.
- ૮) સ્વામીનારાયણ મંદિરની સામે, મરધા કેન્દ્ર રોડ, કાપોદ્રા, સુરત.
- ૯) આંગણવાડીના પ્રથમ માળે, વસંતભીખાની વાડી પાસે, એલ.એચ.રોડ, સુરત.
- ૧૦) સ્વામી વિવેકાનંદ શાળાની સામે, હરીધામ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી રોડ, સુરત.
- ૧૧) શ્રી જવેશંદ મેઘાંશી વાંચનાલય, સરગમ સોસા.પાસે, ટીવીએસ શો રૂમની ગલીમાં, આઈમાતા રોડ, મગોબ, સુરત.
- ૧૨) શ્રી મદનલાલ ધીગરા વાંચનાલય, સરફાઈ કામદાર આવાસની બાજુમાં, ટ્રાન્સપોર્ટ ગોડાઉનની સામે, ટોરેન્ટ પાવરની પાસે, આઈમાતા રોડ, સુરત.
- ૧૩) શ્રી વિનોદ કિનારીવાલા વાંચનાલય, રેણુકાભવન અને રેશમભવનની બાજુમાં, નગર પ્રા.શિક્ષણ સમિતી શાળા નં.૨૫૦, કુલેરનગર રોડ, સુરત.
- ૧૪) ન.પ્રા.શિ.સ.શાળા નં. ૬૮ થી ૭૧ના કંબપાઉન્ડમાં, ખાડી મહોલ્લો, ઉમરવાડા, સુરત.
- ૧૫) ન.પ્રા.શિ.સ.શાળાની સામે, ધનશ્યામનગર સોસા., એસ.એમ.સી.શોપીંગ સેન્ટરના પ્રથમ માળે, સુરત.
- ૧૬) પીર ફળિયું, સીતાનગર ચોક, પુણા ગામ, સુરત.
- ૧૭) શ્રી કેશુભાઈ પટેલ, એસ.એમ.સી. લાયબ્રેરી, સુરત.

મુદ્રા નં. ૧૬ :— જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્રા અને બીજી વિગતો :—

જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્રા અને બીજી વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ WWW.suratmunicipal.gov.in પર નજીકના ટૂંકાળામાં ફેરફાર થયેલ હોય તે સિવાય મહદ અંશે સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે અને તે પણ સમયાંતરે અધ્યતન કરવામાં આવશે તથા ઝોન કચેરી / નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બોર્ડ ઉપર પણ પ્રસિદ્ધ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.



માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫

આર.ટી.આઈ.સેલની કચેરી

ઇસ્ટઝોન (વરાધા) (એ)

સુરત મહાનગરપાલિકા



(૧) અપીલ અધિકારી અને ઈ.ચા.આસી.કમિશનરશ્રી ડી.યુ.રાણે (કર્મ.નં. ૩૭૩૬૦)

(૨) અપીલ અધિકારી અને કાર્યપાલક ઈજનેરશ્રી કે.એલ.વસાવા (કર્મ.નં. ૩૭૦૫૦)

(૩) અપીલ અધિકારી અને જુનિ.મેડીકલ ઓફિસરશ્રી ડી.પી.એસ.પટેલ (કર્મ.નં. ૩૪૮૧૨)

વેબસાઈટ :— www.suratmunicipal.gov.in, કચેરી ફોન

નં.૦૨૬૧–૨૫૫૧૩૬૩, ૨૫૪૭૭૫૦, ૨૫૪૮૩૬૫.

ઇસ્ટઝોન (વરાધા) (એ) કચેરી
જાહેર માહિતી અધિકારીઓના નામ

| અ.નં. | વિભાગનું નામ | જાહેર માહિતી અધિકારીના નામ/હોદ્રો/કર્મચારી નંબર |
|-------|----------------------------|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| ૧ | મહેકમ | શ્રી હિમાંશુ આઈ.ચૌધરી – ઈ.ચા.પર્સોનલ ઓફિસર – ૩૮૮૨૮ |
| ૨ | હિસાબી | શ્રી ભાનુભેન કે.કંથારીયા – ડે.એકાઉન્ટન્ટ – ૧૩૬૫૮ |
| ૩ | આકારણી અને સિવીક સેન્ટર | શ્રી આનંદ વી.ચૌધરી – ઈ.ચા.એ.આર.ઓ. – ૩૭૩૪૧ |
| ૪ | ગુમાસ્તાધારા | શ્રી આનંદ વી.ચૌધરી – ઈ.ચા.વ્યવસાયવેરા અધિકારીશ્રી – ૩૭૩૪૧ શ્રી અંકિત આર. ગોજારીયા – ગુમાસ્તા નિરીક્ષકશ્રી – ૭૪૧૮૮ શ્રી કેતન એલ.આહીર – ગુમાસ્તા નિરીક્ષકશ્રી – ૭૨૨૦૨ શ્રી સ્નેહાલી એમ. દાળવાલા – ગુમાસ્તા નિરીક્ષકશ્રી – ૭૪૨૦૭ |
| ૫ | કાયદા/એપેલેટ | શ્રી ડી.યુ.રાણે – આસી.લો ઓફિસરશ્રી – ૩૭૩૬૦ |
| ૬ | ઈજનેરી | શ્રી આશીષ જી.ગાંધી – ડેપ્યુટી ઈજનેરશ્રી – ૧૧૫૮૪ |
| ૭ | | શ્રી સંજય આર. પટેલ – ડેપ્યુટી ઈજનેરશ્રી – ૧૮૮૮૫ |
| ૮ | | શ્રી જીતેન્દ્ર કે. પટેલ – ડેપ્યુટી ઈજનેરશ્રી – ૧૩૦૩૬ |
| ૯ | | શ્રી મયંક એ. રાવલ – ડેપ્યુટી ઈજનેરશ્રી – ૧૮૮૦૧ |
| ૧૦ | | શ્રી નિલેશકુમાર આર. રામાવાત – ડેપ્યુટી ઈજનેરશ્રી (ઇલેક્ટ્રીક) – ૧૮૮૦૨ |
| ૧૧ | આરોગ્ય સેન્ટેશન | શ્રી અંબુભાઈ જી. પટેલ – ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી – ૧૪૪૦૮ |
| ૧૨ | વી.બી.ડી.સી. | શ્રી જે.ડી.પટેલ – આસી.જંતુનાશક અધિકારીશ્રી – ૧૮૭૯૪ |
| ૧૩ | જન્મ મરણ/ લગ્ન નોંધણી | શ્રી એ.એલ.રાખોલીયા – સ્ટેટેસ્ટીકલ આસીસ્ટન્ટશ્રી – ૪૮૮૩૧ |
| ૧૪ | સરદાર સમૃતી ભવન | શ્રી વિનોદકુમાર એમ. ચોધરી – મેનેજરશ્રી – ૧૩૬૧૭ |

મુદ્રા નં. ૧૭ : અન્ય માહિતી સુરત મહાનગર પાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતેના ખાતાની અવાયદી માહિતી નથી.

**માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫
પૂર્વ(વરાણી) ઝોન(એ)**

| અ. નં. | ઝોન/ ખાતાનું નામ | જાહેર માહિતી અધિકારી નું નામ/ કર્મચારી નં./ હોદ્દો | અપીલ અધિકારીનું નામ / કર્મ. નં. હોદ્દો |
|--------|--------------------------------------------------------------|----------------------------------------------------------------------------------------------------|----------------------------------------------|
| ૧ | પૂર્વ (વરાણી) ઝોન-એ (મહેકમ) ૮૪/૦૪ | શ્રી હિમાંશુ આઈ. ચૌધરી - ૩૬૮૨૮ | ઇ.ચા.પસોનેલ ઓફિસર |
| | પૂર્વ(વરાણી) ઝોન-એ (આકારણી) સીવીક સેન્ટર અને ગુમાસ્તાધારા | શ્રી આનંદ વી. ચૌધરી - ૩૭૩૪૧ | ઇ.ચા.આકારણી અધિકારી |
| | પૂર્વ(વરાણી) ઝોન-એ (હેસાબી ખાતું) | શ્રી ભાનુભેન કે. કંથારીયા - ૧૩૬૫૮ | કે. એકાઉન્ટન્ટ |
| | પૂર્વ(વરાણી) ઝોન-એ (ગુમાસ્તાધારા) | શ્રી અંકિત આર. ગોજારીયા - ૭૪૧૮૮ શ્રી કેતન એલ. આડીર - ૭૪૨૦૨ શ્રી સ્નેહાલી એમ. દાળવાલા - ૭૪૨૦૭ | ગુમાસ્તા ધારા ઈન્સ્પે. |
| | પૂર્વ(વરાણી) ઝોન-એ (કાયદા વિભાગ અને એપેલેટ વિભાગ) | શ્રી ધનંજ્ય યુ. રાણે - ૩૭૩૬૦ | આસી.લો. ઓફિસર અને એપેલેટ ઓફિસર |
| ૨ | પૂર્વ(વરાણી) ઝોન-એ /ઇજનેર વિભાગ | (૧) શ્રી આશીષ જી. ગાંધી - ૧૧૫૮૪ | ઇ.ઇજનેર |
| | | (૨) શ્રી સંજ્ય આર. પટેલ - ૧૮૮૫૫ | ઇ.ઇજનેર |
| | | (૩) શ્રી જીતેન્દ્ર કે. પટેલ - ૧૩૦૩૬ | ઇ.ઇજનેર |
| | | (૪) શ્રી મયુક એ. રાવલ - ૧૮૮૦૧ | ઇ.ઇજનેર |
| | | (૫) શ્રી એન. આર. રામાવત - ૧૯૯૦૨ | ઇ.ઇજનેર(ઇલે.) |
| -> | સરદાર પટેલ સમૃતિભવન વરાણી, ૫૬/૦૪ | શ્રી વી.એમ. ચૌધરી - ૧૩૬૧૭ | મેનેજર |
| ૩ | પૂર્વ(વરાણી) ઝોન-એ (આરોગ્ય વિ. આરોગ્ય સેન્ટી.વિભાગ) | શ્રી અંબુભાઈ જી. પટેલ - ૧૪૪૦૮ | મુખ્ય આરોગ્ય નિરીક્ષક, આરોગ્ય સેનીટેશન |
| | પૂર્વ(વરાણી) ઝોન-એ, જન્મ-મરણ, લગ્ન નોંધણી. | શ્રી અમિત એલ. રાખોલિયા - ૪૮૮૩૧ | સ્ટેટીસ્ટીકલ આસીસ્ટન્ટ |
| | પૂર્વ(વરાણી) ઝોન-એ, વી.બી.ડી.સી. | શ્રી જે. ડી.પટેલ કર્મ. નં. ૧૯૭૯૪ | આસી.જાંનાશક અધિકારી |

ઇ.ચા.સેક્શન ઓફિસર
પૂર્વ(વરાણી) ઝોન(એ)

ઇ.ચા.પસોનેલ ઓફિસર
પૂર્વ(વરાણી) ઝોન(એ)
સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકા
પૂર્વ(વરાણા)ઝોન (એ)
ઓનેક્શર – એ

(સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૫/૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક : પી.એ.ડી.-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-આરટીઆઈ સેલનું બિડાજા)

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી વડી કચેરી (પ્રોપર) તથા મારા વહીવટી કાર્યક્ષેત્રના આ સાથેના યાદી મુજબના જાહેર સત્તામંડળ ધ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો (પ્રોએક્ટીવ ડીસ્કલોઝર) (પી.એ.ડી.) તૈયાર કરવામાં આવી છે, અને તા. ૧૫/૦૬/૨૦૨૩ની સ્થિતીએ તે અધતન કરવામાં આવેલ છે. જેનું અમારા ધ્વારા માહેર મે/જૂન-૨૦૨૩ દરમયાન ઈન્સ્પેક્શન-કમ-ઓડીટ કરવામાં આવ્યું છે.

તા. ૩૦/૦૬/૨૦૨૩ ની સ્થિતીએ હવે કોઈ જાહેર સત્તામંડળોના પ્રોએક્ટીવ ડીસ્કલોઝર (પી.એ.ડી.) નું ઈન્સ્પેક્શન-કમ-ઓડીટ બાકી રહેલ નથી.

| અ.નં. | આરટીઆઈ મુજબ હોદ્દો | હોદ્દો | નામ | વિભાગનું નામ | સહી |
|-------|----------------------|----------------------------------|-------------------------------------|------------------------------------------------------------------------------------------|-----|
| ૧ | અપીલ અધિકારી | ઇ.ચા.આસી. કમિશનર | શ્રી. ડી.યુ.રાણે -૩૭૩૬૦ | મહેકમ, આકારણી, હિસાબી, આકારણી અને સીવીક સેન્ટર, વ્યવસાયવેરા, ગુમાસ્તાધારા, એપેલેટ વિભાગ. | |
| ૨ | અપીલ અધિકારી | કાર્યપાલક ઈજનેર | શ્રી કે.એલ.વસાવા -૩૭૦૫૦ | ઇજનેરી વિભાગ | |
| ૩ | અપીલ અધિકારી | જુનિ. મેડીકલ ઓફિસર | ડૉ. પી.એસ.પટેલ - ૩૬૪૬૮ | આરોગ્ય સેન્ટેશન, જન્મ-મરણ, લગ્ન નોંધણી, વીભીડીસી | |
| ૪ | જાહેર માહિતી અધિકારી | ડે. ઈજનેર | (૧) શ્રી આશીષ જી.ગાંધી - ૧૫૮૪ | ઇજનેરી વિભાગ | |
| ૫ | જાહેર માહિતી અધિકારી | ડે. ઈજનેર | (૨) શ્રી સંજય આર. પટેલ - ૧૮૮૫૪ | ઇજનેરી વિભાગ | |
| ૬ | જાહેર માહિતી અધિકારી | ડે. ઈજનેર | (૩) શ્રી જીતેન્દ્ર કે. પટેલ - ૧૩૦૩૬ | ઇજનેરી વિભાગ | |
| ૭ | જાહેર માહિતી અધિકારી | ડે. ઈજનેર | (૪) શ્રી મયંક એ. રાવલ - ૧૮૮૦૧ | ઇજનેરી વિભાગ | |
| ૮ | જાહેર માહિતી અધિકારી | ડે. ઈજનેર (ઇલે.) | (૫) શ્રી એન.આર.રામાવત - ૧૬૬૦૨ | ઇજનેરી વિભાગ | |
| ૯ | જાહેર માહિતી અધિકારી | ડે. એકાઉન્ટન્ટ | શ્રી ભાનુબેન કે. કંથારિયા - ૧૩૬૫૮ | એકાઉન્ટ વિભાગ | |
| ૧૦ | જાહેર માહિતી અધિકારી | આસી.લો.ઓફિસર અને એપેલેટ ઓફિસર | શ્રી ધનંજય યુ.રાણે -૩૭૩૬૦ | કાયદા ખાતું અને એપેલેટ વિભાગ | |
| ૧૧ | જાહેર માહિતી અધિકારી | ઇ.ચા.પર્સોનેલ ઓફિસર | શ્રી હિમંશુ આઈ.ચૌધરી - ૩૬૬૨૮ | મહેકમ વિભાગ | |
| ૧૨ | જાહેર માહિતી અધિકારી | ઇ.ચા.આકારણી અધિકારી | શ્રી આનંદ વી.ચૌધરી -૩૭૩૪૧ | આકારણી વિભાગ / વ્યવસાયવેરા વિભાગ | |
| ૧૩ | જાહેર માહિતી અધિકારી | મનેજર | શ્રી વી.એમ. ચૌધરી - ૧૩૬૧૭ | સરદાર પટેલ સ્પૃતિભવન વરાણા, ૫૬/૦૪ | |
| ૧૪ | જાહેર માહિતી અધિકારી | ચીફ એસ.આઈ. | શ્રી અંબુભાઈ જી. પટેલ - ૧૪૪૦૮ | આરોગ્ય વિભાગ | |
| ૧૫ | જાહેર માહિતી અધિકારી | આસી. જંતનાશક અધિકારી | શ્રી જે.ડી. પટેલ - ૧૯૭૯૪ | વી.બી.ડી.સી. વિભાગ | |
| ૧૬ | જાહેર માહિતી અધિકારી | ગુમાસ્તા ધારા ઈન્સ્પે. | શ્રી અંકિત આર.ગોઝારીયા - ૭૪૧૬૮ | ગુમાસ્તાધારા વિભાગ | |
| ૧૭ | જાહેર માહિતી અધિકારી | ગુમાસ્તા ધારા ઈન્સ્પે. | શ્રી કેતન એલ.આહીર - ૭૪૨૦૨ | ગુમાસ્તાધારા વિભાગ | |
| ૧૮ | જાહેર માહિતી અધિકારી | ગુમાસ્તા ધારા ઈન્સ્પે. | શ્રી સ્નેહાલી એમ. દાળવાલા - ૭૪૨૦૭ | ગુમાસ્તાધારા વિભાગ | |
| ૧૯ | જાહેર માહિતી અધિકારી | સ્ટેટીસ્ટીકલ આસીસ્ટન્ટ | શ્રી અમિત એલ.રાખોલિયા - ૮૮૮૩૧ | જન્મ-મરણ, લગ્ન નોંધણી. | |